



FAIZANE HAZRATE SABIRE PAK (HINDI)

ਫੇਝਾਨੇ

ਹਜ਼ਰਤੇ ਸਾਬਿਰੇ ਪਾਈ (رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ)

ਮਜ਼ਾਰ ਸ਼ਰੀਕ ਹਜ਼ਰਤੇ ਸਾਬਿਰੇ ਅਲਾਉਦੀਨ ਅਲੀ ਅਹਮਦ ਸਾਬਿਰ ਚਿਖ਼ਟੀ (رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ) (کلਥਰ ਸ਼ਰੀਕ)



أَلْحَنْدُ بِبُورَتِ الْعَلَمِيْنَ وَالشَّلُوْقُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ النَّزَارِيْنَ أَمَا بَعْدُ فَأَعُذُّ بِإِلَهِ مِنَ الْكُفَّارِ الرَّؤْيُونِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

کتاب پढنے کی دعاء

دینی کتاب یا اسلامی ساتھ کتاب پڑھنے سے پہلے جیسا میں دی ہوئی
دعاء پڑھ لیجیے یہ *إِنْ شَاءَ اللَّهُ عَزَّ ذَلِيلٌ* کوچھ پڑھو یاد رکھو گا۔ دعاء یہ ہے :

اللَّهُمَّ افْتَحْ عَلَيْنَا حِكْمَتَكَ وَانْشُرْ عَلَيْنَا رَحْمَتَكَ يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ

ترجیح : اے اللہا ! ہم پر ایکم توہین کے دروازے بلوک دے
اوپر ہم پر اپنی رحمت ناجیل فرماؤ ! اے ارحم اور بخوبی والے !

(مستطرف ج ۴ ص ۱۳۸ دارالفکر بیروت)

نوت : اولیٰ آمیز ایک - ایک بار ہر دفعہ شریف پڑھ لیجیے.

تاکیبے گامے مددینا

بکیا

و ماجکیرت



13 شعبان 1428ھ.

کیامت کے روز حساب

فرمانے مुسٹکا : ﷺ : ساتھ سے جیسا دعا ہے

کیامت کے دن وہ کوئی جیسے ہوئے ہے میں ایکم ہاسیل کرنے کا مہک ای
میلہ مگر وہ نے ہاسیل نہ کیا اور وہ شاہس کو کوئی جیسے نے ایکم
ہاسیل کیا اور دوسرا نے تو وہ سے سون کر نہ کیا اور ایکم وہ نے
نہ کیا (یا نہیں) وہ ایکم پر امداد نہ کیا)

(تاریخ دمشق لابن عساکر ج ۱ ص ۱۳۸ دارالفکر بیروت)

کتاب کے بارے میں جو جانتے ہیں

کتاب کی تباہی میں نعمایاں برآبی ہو یا سکھات کم ہوں یا بائیکنگ میں
آگے پیٹھے ہو گئے ہوں تو مکتبتوں مددینا سے رجوع فرمائیے۔

الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ النَّبِيِّنَ امَّا بَعْدُ فَاعُوذُ بِاللّٰهِ مِنَ الشَّيْطَنِ الرَّجِيمِ طِبْيَنِ اللّٰهِ الرَّجِيمِ الرَّجِيمِ طِبْيَنِ اللّٰهِ الرَّجِيمِ الرَّجِيمِ

મજલિસે તરાજિમ હિન્ડ (દા'વતે ઈસ્લામી)

ઈલ્લાહُ لِلّٰهِ عَزَّلَهُ
દા'વતે ઈસ્લામી કી મજલિસ “અલ મદીનતુલ ઈલ્મયા” ને યેહ રિસાલા ઉર્ડૂ જ્બાન મેં પેશ કિયા છે ઓર મજલિસે તરાજિમ ને ઈસ રિસાલે કા ગુજરાતી રસ્મુલ ખત કરને કી સાચાદત હાસિલ કી છે. ભાષાંતર (**Translation**) નહીં બાલ્ક સિર્ક લીપિયાંતર (**Transliteration**) યા'ની બોલી તો ઉર્ડૂ હી છે જબ કી લીપિ ગુજરાતી કી ગઈ છે ઓર મકતબતુલ મદીના સે શાખેએ કરવાયા છે.

ઈસ રિસાલે મેં અગાર કિસી જગાહ ગલતી પાછે તો મજલિસે તરાજિમ કો સફા ઓર સતર નમ્બર કે સાથ **Sms**, **E-mail**, **Whats App** યા **Telegram** કે જરીએ ઇતિલાઅ ટે કર સવાબે આધિકરણ કરીએ.

મદની ઇલિજા: ઈસ્લામી બહને ડાયરેક્ટ રાખિતા ન કરમાંઓ!!!



મદની મર્કઝ, કાસિમ હાલા મસ્જિદ નાગર વાડા, બરોડા, ગુજરાત અલ હિન્ડ ૯૩૨૭૭૭૬૩૧૧
E-mail : tarajim.hind@dawateislami.net

ઉર્ડૂ શે ગુજરાતી રસ્મુલ ખત (લીપિયાંતર) ખાડા

થ = ત્થ	ત = ત	ફ = ફ્ફ	પ = પ્પ	ભ = ભ્ભ	બ = બ્બ	અ = િ
છ = છ્છ	ચ = છ	ઝ = ઝ્ઝ	જ = જ	સ = છ	ઠ = ઠ્ઠ	ટ = ટ્ટ
ઝ = જ્ઝ	ચ્ચ = ચ	ઝ્ઝ = ઝ	જ્જ = જ	સ્સ = છ	ઠ્ઠ્ઠ = ઠ	ટ્ટ્ટ = ટ
ઝ = જ	ચ્ચ = હ્ચ	ઝ્ઝ = હ્ઝ	જ્જ = હ્જ	સ્સ = હ્સ	ઠ્ઠ્ઠ = હ્ઠ	ટ્ટ્ટ = હ્ટ
શ = શ	સ = સ	જ = જ્જ	ઝ = જ	ઠ = હ્ઝ	ર્ઝ = ર્જ	ર = ર
ફ = ફ	ગ = ગ્ઘ	અ = અ	ઝ = ઝ	ત = ત્થ	ઝ = ઝ્ઝ	સ = સ
ભ = મ	લ = લ	ધ = ધ્ધ	ગ = ગ્ગ	ખ = ખ્ખ	ક = ક્ક	ક = ક
ગ = ત્ત	વ = ફ્ફ	આ = ઊ	ય = ય	દ = ન્ન	વ = ઓ	ન = ન

الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْبُرَسَلِيْنَ
أَمَّا بَعْدُ فَاعُوذُ بِاللّٰهِ مِنَ الشَّيْطَنِ الرَّجِيمِ طَبِيْسِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ط

ફેઝાને હજરતે સાબિરે પાક

દુર્દશ શરીફ કી ફરીલત

રસૂલે અકરમ, નૂરે મુજસ્સમ صَلَّى اللّٰهُ تَعَالٰى عَلٰيْهِ وَبَوَّسَلَمَ કા ફરમાને મુખ્યમાં હૈ : જિસ ને મુજ પર સો મરતબા દુર્દશ પાક પઢા **આલ્હાન** ઉંગલ ઉસ કી દોનોં આંખોં કે દરમિયાન લિખ દેતા હૈ કુ યેહ નિઝાક ઔર જહન્નમ કી આગ સે આજાદ હૈ ઔર ઉસે બરોજે કિયામત શુહ્દા કે સાથ રખેગા।⁽¹⁾

صَلُّوا عَلَى الْحَكِيْمِ !

કમાલે સભ્ર ને સાબિર બના દિયા

સિલસિલાએ આલિયા ચિશિતયા કે અનીમ બુગુર્હ હજરતે બાબા ફરીદુદ્દીન મસઉદ ગંજે શકર رَحْمَةُ اللّٰهِ تَعَالٰى عَلٰيْهِ કી બારગાહ મેં આપ رَحْمَةُ اللّٰهِ تَعَالٰى عَلٰيْهِ કે સાદાત મન્દ ભાંજે ઔર મુરીદ તરબિયત હાસિલ કરને કે લિયે હાલ્કિર હુવે તો આપ رَحْمَةُ اللّٰهِ تَعَالٰى عَلٰيْهِ ને સબ સે પહલે ફર્જ ઔર નફલ નમાજોં પર ઈસ્તકામત ઈજિતયાર કરને કી નસીહત ફરમાઈ ઔર ઈન્હેં લંગર ખાને કી જિમ્મેદારી સોંપ દી. ચૂંકિ મુરીદ ને લંગર કી તકસીમ કા હુકમ ફરમાયા થા ઉસ મેં સે ખાને કી સરાહત નહીં કી થી લિહાજા યેહ સાદાત મન્દ મુરીદ

1 ... مَجْمُوعَ الرَّوَايَاتِ، كِتَابُ الْاِدْعَيْةِ، بَابُ فِي الصَّلَاةِ عَلَى النَّبِيِّ الْخَٰنِ، ١٠، حَدِيثٌ: ٢٥٣ / ١٧٢٩٨، مُسْقَطَةً

હુકમે મુર્શિદ કી બજા આવરી કરતે હુવે લંગર ખાને સે ખાના તકસીમ ફરમાતા લેકિન ખુદ એક લુકમા ભી ન ખાતા. પૂરા હિન રોજે સે રહતા ઔર જંગલી દરખ્ટ કે પત્તોં, કૂંપલોં, ફલોં ઔર ફૂલોં સે ઈફતાર કર લિયા કરતા. એક અર્સે તક યેહ સિલસિલા જારી રહા લેકિન ઈસ મુજહદે કી વજહ સે જિસ નિહાયત કમજોર ઔર લાગર હો ગયા. જબ હજરતે બાબા ફરીદુદીન મસ઼ાઓ ગંજે શકર રહેતે હતે નથી^{رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ} ને અપને સાચાદત મન્દ ભાંજે ઔર કામિલ મુરીદ કી યેહ કેફિયત મુલાહજા ફરમાઈ તો આપ ^{رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ} ને પૂછા : આપ ખાના તકસીમ કર કે ખુદ ભી કુછ ખાતે હું યા નહીં ? સાચાદત મન્દ મુરીદ ને નજરેં જુકા લીં ઔર યેહ ખૂબ સૂરત જવાબ બારગાહે મુર્શિદ મેં અર્જ ડિયા : આલીજાહ ! આપ ને ખિલાને કા હુકમ ઈરશાદ ફરમાયા થા, મુજ મેં ઈતની જુરઅત કહાં કિ મુર્શિદ કી ઈજાજત કે બિગેર એક દાના ભી ખા સકું ? યેહ જવાબ સુન કર હજરતે બાબા ફરીદ ^{رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ} સાચાદત મન્દ ભાંજે ઔર કામિલ મુરીદ કે કમાલે સથ્વ સે બહુત ખુશ હુવે ઔર સીને સે લગા કર સાબિર કા લકબ અતા ફરમાયા.(1)

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! હજરતે સાચિદુના ફરીદુદીન મસ઼ાઓ ગંજે શકર ^{رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ} કી બારગાહ સે સાબિર કા લકબ પાને વાલે કામિલ મુરીદ “સુલ્તાનુલ ઔદિયા, કુતબે આલમ, બાનિયે સિલસિલાએ ચિશિતયા સાબિરિયા હજરતે સાચિદ અલાઉદીન અલી અહુમદ સાબિર કલયરી ^{رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ} કે યું તો હું હું.” આપ ^{رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ} કે યું તો

①.....**અલ્લાહ** કે ખાસ બન્ટે, સ. 578 મુલખ્યસન, સિયરલ અક્તાબ, સ. 200 મુલખ્યસન, ખજીનતુલ અસ્કિયા, 2 / સ. 153 મુલખ્યસન, ઈકિતબાસુલ અન્વાર, સ. 498 મુલખ્યસન, બહાઉદીન ઝકરિયા મુલ્તાની, સ. 86

બેશુમાર ઔસાફ હું લેકિન મુર્શિદે કરીમ કી મુખારક જવાન સે મિલને વાલા લકબ આપ **رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ** કી શોહરત કા સબબ બના ઔર આપ **رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ** કો હજરતે સાબિરે પાક કે નામ સે યાદ કિયા જાને લગા.

વિલાદતે બા સાચાદત

આપ **رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ** કી વિલાદત 19 રખીઉલ અવ્યવ સિને 592 હિજરી મુતાબિક 19 ફરવરી સિને 1196 ઈસવી કો બ વક્તે તહજુદ બરોજ જુમા'રાત હરાત (અફગાનિસ્તાન) મેં હુદ્દ. આપ કુ વુજૂદ મસાઓ નૌમૌલૂદ હોને કે બા વુજૂદ ઐસા થા કિ દાયા કો બે વુજૂ ગુસ્લ કરાને કી હિન્મત ન હુદ્દ.⁽¹⁾

શાજરાએ નસબ

આપ **رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ** કા શાજરાએ નસબ યેહ હૈ : સાધ્યદ અલાઉદીન અલી અહમદ સાબિર બિન સાધ્યદ અબ્ડુરહીમ બિન સાધ્યદ અબ્ડુસ્લામ બિન સાધ્યદ સૈફુદીન બિન સાધ્યદ અબ્ડુલ વહ્ડાબ બિન ગૌસુલ આ'જમ સાધ્યદુના શૈખ અબ્ડુલ કાદિર જીલાની (રَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ عَلَيْهِمْ أَجْمَعُونَ) ⁽²⁾ બા'જ ને આપ **رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ** કા શાજરાએ નસબ યેહ તહરીર ફરમાયા હૈ : અલી અહમદ બિન સાધ્યદ અબ્ડુલ્લાહ બિન સાધ્યદ ફિત્હુલ્લાહ બિન સાધ્યદ નૂર મુહમ્મદ બિન સાધ્યદ અહમદ બિન સાધ્યદ ગિયાસુદીન બિન સાધ્યદ બહાઉદીન બિન સાધ્યદ દાવૂદ બિન સાધ્યદ તાજુદીન બિન સાધ્યદ મુહમ્મદ

① અલ્વાઈ કે ખાસ બન્ટે, સ. 574, મહફિલે ઔલિયા, સ. 382 મુલઘસન

② તાજકિરાએ ઔલિયાએ બર્રે સગીર, 2 / 1

ઈસ્માઈલ બિન સથિદ ઈમામ મૂસા કાજિમ બિન સથિદ ઈમામ જા'ફર સાદિક બિન સથિદુશુહદા હજરતે ઈમામે હુસૈન બિન હજરતે સથિદુના અલિયુલ મુર્તજા⁽¹⁾. લેકિન ઈસ બાત કો સહીહ કરાર દિયા ગયા હૈ કિ આપ રહ્માત‌લાલ ઉદ્ડેશ્યાનું હસની સથિદ હૈ ઔર ગૌસે આ'ઝમ રહ્માત‌લાલ ઉદ્ડેશ્યાનું કુદી ઔલાદ સે હૈનું.⁽²⁾ આપ રહ્માત‌લાલ ઉદ્ડેશ્યાનું કે વાલિદ કા નામ અખુલ્લાહ બિન અખુર્રહીમ ભી જિક કિયા ગયા હૈ.⁽³⁾

કાન મેં અગ્નાન

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! બચ્ચા પૈદા હો તો મુસ્તહબ હૈ કિ ઉસ કે કાન મેં અગ્નાન વ ઈકામત કહી જાએ કિ ઈસ તરહ ઈન્જિટિદા હી સે બચ્ચે કે કાન મેં **અલ્લાહ ગુર્જાલ** ઔર ઉસ કે પ્યારે મહબૂબ, દાનાએ ગુયૂબ કા નામ પહુંચ જાએગા। ઈસ તરહ એક મુસલમાન બચ્ચે કે લિયે ઈસ્લામ કે બુન્યાદી અકાઈદ સિખાને કા ભી આગાજ હો જાતા હૈ, બચ્ચે કી રૂહ નૂરે તૌછીદ સે મુનવ્વર હો જાતી હૈ ઔર ઉસ કે દિલ મેં ઈશ્કે રસૂલ **صلી اللہُ تَعَالَى عَلَيْهِ وَآلِہ وَسَلَّمَ** કી શરૂઆ ફરોજાં હોતી હૈ. હમારે પ્યારે આકા **صلી اللہُ تَعَالَى عَلَيْهِ وَآلِہ وَسَلَّمَ** ને અપને નવાસે હજરતે સથિદુના હસન બિન અલી રહ્માત‌લાલ ઉદ્ડેશ્યાનું કે કાન મેં ખુદ અગ્નાન દી જૈસા કિ હજરતે સથિદુના અબૂ રાફીઅ રહ્માત‌લાલ ઉદ્ડેશ્યાનું હૈનું : જબ હજરતે સથિદુના ફાતિમા રહ્માત‌લાલ ઉદ્ડેશ્યાનું કુદી હૈનું હજરતે સથિદુના હસન બિન અલી રહ્માત‌લાલ ઉદ્ડેશ્યાનું કુદી વિલાદત હુદ્દ તો

①ઇખરલ તવારીખ, સ. 276 ગૈર મતબૂઅા

②હજરતે મખૂમ અલાઉદ્દીન અલી અહમદ સાબિર કલયરી, સ. 44

③હજરતે મખૂમ અલાઉદ્દીન અલી અહમદ સાબિર કલયરી, સ. 56

મૈં ને **અલ્લાહ** કે મહિબૂબ, દાનાએ ગુયુબ કુરોજલ મહિબૂબ, દાનાએ ગુયુબ, દાનાએ ગુયુબ કુરોજલ કે ઉન કે કાન મેં નમાજ વાલી અગ્રાન દેતે દેખા. (1) હજરતે સાયિદુના અલાઉદીન અલી અહ્મદ સાબિર રહ્માન રહ્માન કે કાન મેં હજરતે સાયિદુના અભુલ કાસિમ ગિરગાની રહ્માન રહ્માન ને અગ્રાન દી ઔર ફરમાયા : યેહ બચ્ચા કુતબે આલમ હોગા. (2)

નામ વ લકબ મેં ભી ઇમિતયાગી શાન

મન્ડૂલ હૈ કિ આપ રહ્માન રહ્માન કી વિલાદત સે કળ હજરતે સાયિદુના અલિયુલ મુર્તજા ને ખવાબ મેં “અલી” નામ રખને કા હુકમ ફરમાયા કિર નાનિયે અકરમ, નૂરે મુજસ્સમ રહ્માન ને ખવાબ મેં તશરીફ લા કર “અહ્મદ” નામ રખને કા હુકમ ફરમાયા. યું આપ રહ્માન રહ્માન કા નામ અલી અહ્મદ રખા ગયા. આપ રહ્માન રહ્માન કે વાલિદે ગિરામી સે મુલાકાત કે લિયે તશરીફ લાએ ઔર આપ કો દેખ કર ફરમાયા : “યેહ બચ્ચા અલાઉદીન કહલાએગા.” (3)

આપ રહ્માન રહ્માન કે મામું હજરતે સાયિદુના બાબા ફરીદુદીન ગંજે શકર ને આપ રહ્માન રહ્માન કો સાબિર કા લકબ અતા ફરમાયા (4) યેહી વજહ હૈ કિ આપ રહ્માન રહ્માન કો “અલાઉદીન અલી અહ્મદ સાબિર” કે નામ સે શોહરત હાસિલ હૈ.

١... ترمذى، كتاب الأضاحى، باب الاذان فى اذن المولود، ١٧٣/٣، حديث: ١٥١٩

૨.....**અલ્લાહ** કે ખાસ બન્દે, સ. 575 મુલાખ્સસન

૩.....હજરતે મખૂમ અલાઉદીન અલી અહ્મદ સાબિર કલયરી, સ. 42 મુલાખ્સસન

૪.....**અલ્લાહ** કે ખાસ બન્દે, સ. 575 મુલાખ્સસન, હજરતે મખૂમ અલાઉદીન અલી અહ્મદ સાબિર કલયરી, સ. 42 મુલાખ્સસન

વાલિદેન

આપ રَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ ને જિસ ધરાને મેં આંખ ખોલી વોહ હજરતે સચ્ચિદાનંદના ગૌસે આ'જમ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ સે નસબી તબલ્લુક હોને કે સાથ સાથ ઈલ્મો અમલ, જોહ્રદો તકવા ઔર સભ્રો કનાઅત કા મર્કજ થા. આપ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કે વાલિદ, નબીરએ ગૌસે આ'જમ હજરતે સચ્ચિદાના અબ્હુલ્લાહ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કી તા'લીમો તરબિયત બગાદાદ કે ઈલમી માહોલ મેં હુઈ થી જિસ કી બિના પર આપ ઈલ્મો અમલ મેં બે મિસાલ થે. આપ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કી વાલિદા હજરતે સચ્ચિદાના ધાજિરા નસબન ફારૂકી થીં ઈસી લિયે હજરતે સચ્ચિદાના અલી અહમદ સાબિર رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કી તબીઅત મેં ફારૂકી જલાલ ભી નુમાયાં થા. જબ આપ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કી ઉમ્ર પાંચ સાલ હુઈ તો આપ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કે વાલિદ માજિદ કા ઈન્નિકાલ હો ગયા. આપ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કી વાલિદા ને આપ કી તરબિયત ફરમાઈ. ⁽¹⁾

ગબાન સે અદા હોને વાલા પહુલા જુમલા

હજરતે સચ્ચિદાના અલાઉદીન અલી અહમદ સાબિર કલયરી ને જિસ ધર મેં આંખ ખોલી વોહ તિલાવતે કુરઆન ઔર દિકે ઈલાહી સે મુઅત્તર રહતા થા યેહી વજહ હૈ કે આપ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કી જબાન સે જો પહુલા લફ્જ નિકલા વોહ لَا مَوْجُودٌ إِلَّا اللَّهُ થા. ⁽²⁾

① અલ્લાહ કે ખાસ બન્દે, સ. 574 મુલાખ્સસન, હજરતે મખૂમ અલાઉદીન અલી અહમદ સાબિર કલયરી, સ. 48 મુલતકતન

② તજકિરએ ઔલિયાએ પાકો હિન્દ, સ. 63

ગજાન ખુલને કે બા'દ અલ્લાહُ ﷺ કા નામ સિખાઈયો

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! જિન્હેં અલ્લાહُ ﷺ ને ઔલાદ કી ને'મત સે નવાજા હૈ ઉન્હેં ચાહિયે જબ બચ્ચા જરા હોશિયાર હો જાએ ઓર જબાન ખોલને લગે તો સબ સે પહ્લે ઉસ કે ખાલિકો માલિક ઓર રાજિક કા ઈસ્મે જાત “**અલ્લાહُ**” સિખાએં ઓર ઈસ બાત કા ભી ઈલિજામ કરેં કિ ઈસ કી પાકો સાફ જબાન સે સબ સે પહ્લે કલિમએ તથિબા હી જારી હો. હિતરે સચિદુના ઈબ્ને અભિસાસ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُمَا સે મરવી હૈ કિ હુન્દૂરે પાક, સાહિબે લૌલાક صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ ને ફરમાયા : “અપને બચ્ચોં કી જબાન સે સબ સે પહ્લે લાલાلَّا إِلَهَ إِلَّا اللَّهُ કહલવાઓ.”⁽¹⁾

બચ્ચે કો જિકુલાહ ઐસે સિખાઈયો

શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત બાનિયે દા'વતે ઈસ્લામી હિતરે અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અતાર કાદિરી રજવી ડામથ بِرَبِّكَاثُمُ الْغَالِيَه ને અપની નવાસી કે લિયે સબ ધરવાલોં કો કહ રખા થા કિ ઉસ કે સામને “**અલ્લાહ-અલ્લાહ**” કા જિક કરતે રહેં તાકિ ઉસ કી જબાન સે પહ્લા લફ્જ **“અલ્લાહ”** નિકલે ઓર જબ વોહ નવાસી આપ ડામથ بِرَبِّكَاثُمُ الْغَالِيَه કી બારગાહ મેં લાઈ જાતી તો

١... شعب الایمان، باب فی حقوق الاولاد، ٣٩٤/٢، حدیث: ٨٤٣٦

આપ ખુદ ભી ઉસ કે સામને જિફુલ્લાહ કરતે. ચુનાન્યે, જબ ઉસ ને બોલના શુરૂઆ કિયા તો પહોલા લફ્જ “**અલ્હાન**” હી બોલા. ⁽¹⁾

તહજ્જુદ કી પાબન્દી ફરમાતે

હજરતે સાધ્યદુના અલાઉદીન અલી અહમદ સાબિર કલયરી **રહ્મતીલીલ્હે** ને છે સાલ કી ઉમ્ર સે બા કાઈદા ખુશૂઆ વ ખૂજૂઆ કે સાથ નમાજ અદા કરની શુરૂઆ કર દી થી ઔર કહા જાતા હૈ કે સાતવાં સાલ શુરૂઆ હોને પર આપ **રહ્મતીલીલ્હે** ને પાબન્દી કે સાથ તહજ્જુદ કી નમાજ પઠની શુરૂઆ કર દી. દિન મેં હર વક્ત ઈબાદતે ઈલાહી મેં મશગૂલ રહતે. બાંધિક નમાજે તહજ્જુદ કે બા'દ અકસર આપ **રહ્મતીલીલ્હે** કે હુજરે સે જિફુલ્લાહ કી આવાજે સુનાઈ દેતી થી. ⁽²⁾

બચપન કી એક ઘ્યારી આદત

હજરતે સાધ્યદુના અલાઉદીન અલી અહમદ સાબિર ચિશતી **રહ્મતીલીલ્હે** કી ઉમ્ર જબ એક સાલ હુઈ તો એક દિન દૂધ નોશ ફરમાતે જબ કિ દૂસરે દિન દૂધ ન પીતે, જબ આપ **રહ્મતીલીલ્હે** દો સાલ કે હુવે તો એક દિન દૂધ પીને કે બા'દ દો દિન તક દૂધ નોશ ન ફરમાતે. ⁽³⁾

①તરબિયતે ઔલાદ, સ. 100

②**અલ્હાન** કે ખાસ બન્દે, સ. 576

③**અલ્હાન** કે ખાસ બન્દે, સ. 576 માખૂજન, તજકિરાએ ઔલિયાએ પાકો હિન્દ, સ. 63 માખૂજન

ਛੋਟੀ ਸੀ ਉਮ्र ਮੈਂ ਹੀ ਰੋਗ ਰਖਨੇ ਕਾ ਮਾ'ਮੂਲ

ਆਪ رَحْمَةُ اللّٰهِ تَعَالٰى عَلٰيْہِ ਕਾ ਛੋਟੀ ਉਮਰ ਦੇ ਹੀ ਰੋਗ ਰਖਨੇ ਕਾ ਮਾ'ਮੂਲ ਥਾ ਔਰ ਮੁਸਲਿਮ ਰੋਗ ਰਖਨੇ ਦੀ ਧੇਹ ਆਵਟ ਆਪ رَحْمَةُ اللّٰهِ تَعَالٰى عَلٰيْہِ ਕੀ ਆਖਿਰੀ ਉਮਰ ਤਕ ਜਾਰੀ ਰਹੀ।⁽¹⁾

ਰੋਗ ਦੇ ਸਿਫ਼ਾਹ ਮਿਲਤੀ ਹੈ

ਮੀਠੇ ਮੀਠੇ ਈਸ਼ਵਰੀ ਭਾਈਂਧੀ ! ਰੋਗ ਰਖਨੇ ਕੀ ਬਰਕਤਾਂ ਕੇ ਭੀ ਕਿਆ ਕਿਹਨੇ ! ਰੋਗ ਰਖਨੇ ਦੇ ਸਿਫ਼ਾਹ ਮਿਲਤੀ ਹੈ. ਅਮੀਰਲ ਮੌਮਿਨੀਨ ਹੁਕਰਤੇ ਮੌਲਾਏ ਕਾਏਨਾਤ, ਅਲਿਥ੍ਯੁਲ ਮੁਰਤਜਾ ਸ਼ੇਰੇ ਘੁਦਾ كَرَمُ اللّٰهِ تَعَالٰى وَجْهُهُ الْكَٰبِيْنِيْمِ ਦੇ ਰਿਵਾਯਤ ਹੈ ਕਿ ਰਸੂਲ ਮਕਬੂਲ, ਸਥਿਦਾ ਆਮਿਨਾ ਦੇ ਗੁਲਸ਼ਾਨ ਦੇ ਮਹਕਤੇ ਕੂਲ ਕਾ ਫਰਮਾਨੇ ਸਿਫ਼ਾਹ ਨਿਸ਼ਾਨ ਹੈ : ਬੇਸ਼ਕ **ਅਲਵਾਣ** غَزِّيْجُلْ ਨੇ ਬਨੀ ਈਸਰਾਈਲ ਦੇ ਏਕ ਨਵੀ ਪ੍ਰਾਚੀਨ ਮੁਹੱਿਮ ਦੀ ਤਰ੍ਹਾਂ ਵਹੀ ਫਰਮਾਈ ਕਿ ਆਪ ਅਪਨੀ ਕੌਮ ਕੋ ਖ਼ਬਰ ਦਿਕਿਧੇ ਕਿ ਜੋ ਬਨਦਾ ਭੀ ਮੇਰੀ ਰਿਆ ਦੇ ਲਿਧੇ ਏਕ ਦਿਨ ਕਾ ਰੋਗ ਰਖਤਾ ਹੈ ਤਾਂ ਮੈਂ ਉਸ ਦੇ ਜਿਸਮ ਕੋ ਸਿਫ਼ਾਹ ਭੀ ਅਤਾ ਫਰਮਾਤਾ ਹੂੰ ਔਰ ਉਸ ਦੀ ਅਜੀਬ ਅਜ ਭੀ ਢੂਗਾ।”⁽²⁾ ਈਸ ਹਟੀਸੇ ਪਾਕ ਦੇ ਮੁਸਤਕਾਦ (ਸੁਣ + ਥਾਂਫਾਰ) ਹੁਵਾ ਕਿ ਰੋਗ ਅਜੋ ਸਵਾਬ ਦੇ ਸਾਥ ਹੁਸੂਲੇ ਸਿਫ਼ਾਹ ਕਾ ਭੀ ਝੀਕੀਆ ਹੈ. ਅਥ ਤੋ ਸਾਈਨਸਿਦਾਨ ਭੀ ਅਪਨੀ ਤਹਕੀਕਾਤ ਮੈਂ ਈਸ ਹਟੀਕਤ ਦੀ ਤਰ੍ਹਾਂ ਕਰਨੇ ਲਗੇ ਹੈਂ. ਜੈਸਾ ਕਿ ਓਕਸਫ਼ੋਰਡ ਯੂਨੀਵਰਸਿਟੀ ਦੀ ਪ੍ਰੋਫੈਸਰ ਮੂਰ ਪਾਲਿਡ (MOORE PALID) ਕਹਤਾ ਹੈ : “ਮੈਂ ਈਸ਼ਵਰੀ ਭਾਈਂਧੀ

1 **ਅਲਵਾਣ** ਦੇ ਖਾਸ ਬਨਦੇ, ਸ. 576 ਮਾਖੂਜਨ, ਤਾਜ਼ਕਿਰਾਏ ਔਲਿਯਾਏ ਪਾਕੋ ਹਿੰਦ, ਸ. 63 ਮਾਖੂਜਨ

2 شعب الایمان، الباب الثالث والعشرون، فصل اخبار و حکایات فی الصیام، ۳۹۲۳: ۳/۱۱/۳، حدیث:

ਉਲੂਮ ਪਥ ਰਹਾ ਥਾ, ਜਬ ਰੋਜ਼ੋਂ ਕੇ ਬਾਰੇ ਮੌਜੂਦਾ ਤੋ ਉਛਲ ਪਤਾ ਕਿ ਇੱਖਲਾਮ ਨੇ ਅਪਨੇ ਮਾਨਨੇ ਵਾਲੋਂ ਕੀ ਕੇਸਾ ਅਜੀਮੁਸ਼ਾਨ ਨੁਹਾ ਦਿਯਾ ਹੈ ! ਮੁੜੇ ਭੀ ਸ਼ੌਕ ਹੁਵਾ, ਲਿਹਾਜਾ ਮੈਂ ਨੇ ਮੁਸਲਿਮਾਨਾਂ ਕੀ ਤਰ੍ਹ ਪਰ ਰੋਜ਼ ਰਖਨੇ ਸ਼ੁਰੂਆਂ ਕਰ ਦਿਧੇ. ਅਚੰਭਾਏ ਦਰਾਜ਼ ਸੇ ਮੇਰੇ ਮੇਂਦੇ ਪਰ ਵਰਮ ਥਾ. ਕੁਝ ਹੀ ਇਨ੍ਹਾਂ ਕੇ ਬਾਦ ਮੁੜੇ ਤਕਲੀਫ਼ ਮੈਂ ਕਮੀ ਮਹਿਸੂਸ ਹੁਈ. ਮੈਂ ਰੋਜ਼ ਰਖਤਾ ਰਹਾ ਧਹਾਂ ਤਕ ਕਿ ਏਕ ਮਹੀਨੇ ਮੈਂ ਮੇਰਾ ਮਰਜ਼ ਬਿਲੁਕਲ ਖਤਮ ਹੋ ਗਿਆ.”⁽¹⁾

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلُّوا عَلَى الْحَبِيبِ!

ਬਚਪਨ ਹੀ ਮੈਂ ਸਜਦਾਂ ਦੇ ਮਹਿਸੂਤ

ਆਪ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ ਕੋ ਬਚਪਨ ਹੀ ਦੇ ਇਥਾਂਤੋ ਰਿਧਾਤ ਕਾ ਸ਼ੌਕ ਥਾ. ਖਾਸ ਤੌਰ ਪਰ ਬਾਰਗਾਡੇ ਇਲਾਹੀ ਮੈਂ ਸਜਦਾ ਰੋਜ਼ ਹੋਨਾ ਆਪ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ ਕੋ ਬਹੁਤ ਪਸੰਦ ਥਾ ਇਸੀ ਲਿਧੇ ਆਪ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ ਇਨ ਕੇ ਮੁਖਤਲਿਫ਼ ਔਕਾਤ ਮੈਂ ਛੇ ਮਰਤਬਾ ਸਜਦਾ ਫਰਮਾਯਾ ਕਰਤੇ ਔਰ ਆਪ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ ਕੀ ਮੁਬਾਰਕ ਜ਼ਬਾਨ ਪਰ لَا مَوْجُودَ لِأَللَّاهِ ਕਾ ਵਿਰਦ ਜਾਰੀ ਰਹਾ ਕਰਤਾ।⁽²⁾

ਮੀਠੇ ਮੀਠੇ ਇੱਖਲਾਮੀ ਆਈਧੋ ! ਬਚਚਾ ਅਪਨੇ ਬਚਪਨ ਮੈਂ ਜੋ ਕੁਝ ਸੀਖਤਾ ਹੈ ਵੋਹ ਸਾਰੀ ਜ਼ਿਨ੍ਦਗੀ ਉਸ ਕੇ ਜੇਹੜਨ ਮੈਂ ਰਾਸਿਖ ਰਹਤਾ ਹੈ ਕ੍ਰੂਡਿ ਬਚਚੇ ਕਾ ਇਮਾਗ ਮਿਸਲੇ ਮੌਮ ਹੋਤਾ ਹੈ ਉਸੇ ਜਿਸ ਸਾਂਚੇ ਮੈਂ ਫਾਲਨਾ ਚਾਹੁੰ ਫਾਲਾ ਜਾ ਸਕਤਾ ਹੈ ਧੇਣੀ ਵਿਛਲ ਹੈ ਕਿ ਬਚਚੋਂ ਪਰ ਘਰ ਕਾ ਮਾਹੀਲ ਬਹੁਤ ਜਿਧਾਦਾ ਅਸਰ ਅਨਦਾਜ਼ ਹੋਤਾ ਹੈ. ਅਗਰ ਘਰ ਮੈਂ ਮਦਨੀ ਮਾਹੀਲ ਹੋ ਤੋ ਇਸ ਕੀ ਬਰਕਤ ਦੇ ਛੋਟੀ ਉਮ੍ਰ ਹੀ ਦੇ ਉਸ ਕੀ ਜ਼ਬਾਨ ਪਰ

① ਫੈਸ਼ਨ ਸੁਨਨਾ, ਬਾਬ ਫੈਸ਼ਨ ਰਮਾਨ, ਸ. 939

② ਅਲਵਾਨ ਕੇ ਖਾਸ ਬਨਦੇ, ਸ. 575 ਮੁਲਾਖਸਨ

અહ્વાન-અહ્વાન, નબિયે કરીમ ﷺ કા મુખારક
નામ ઔર મદીના-મદીના જારી હો જતા હૈ, બચપન હી સે સલામ
કરને મેં પહુલ કરને કી આદત ડાલી જાએ તો વોહ ઉમ્ર ભર ઈસ
આદત કો નહીં છોડતા, અગર સચ બોલને કી આદત ડાલી જાએ
તો વોહ સારી ઉમ્ર ઝૂટ સે બેઝાર રહતા હૈ, અગર ઉસે સુન્નત કે
મુતાબિક ખાને પીને, બૈઠને, જૂતા પહનને, લિબાસ પહનને, સર
પર ઈમામા બાંધને ઔર બાલોં મેં કંધી વગેરા કરને કા આદી બના
દિયા જાએ તો વોહ ન સિર્ફ ખુદ ઈન પાકીજા આદત કો અપનાએ
રખતા હૈ બલિક ઉસ કે યેહ મદની ઔસાફ ઉસ કી સોહબત મેં રહને
વાલે દીગર બચ્ચોં મેં ભી મુન્તાકિલ હોના શુરૂઆ હો જાતે હૈન. અગર
આપ ભી ચાહતે હૈન કે આપ કી ઔલાદ આંખોં કી ઠન્ડક ઔર હિલ
કા ચૈન બને તો અપને મદની મુન્જોં ઔર મદની મુન્જિયોં કી ઈભિતદા
હી સે તરબિયત કીજિયે ઔર અપની તરબિયત કે લિયે સુન્નતોં ભરે
ઈજતિમાઆત, મદની મુજાકરોં ઔર મદની કાફિલોં મેં સફર કીજિયે
તાકિ આપ કા જાહેરો બાતિન નેકિયોં સે મુજયન હો ઔર ઈસ કી
બરકત સે ઘર મેં સુન્નતોં ભરા મદની માહોલ બનાને મેં આસાની હો.

સાંપ કે ઝરર સે નજાત કી ખુશ ખબરી

એક રોજ હજરતે સાબિરે પાક رَحْمَةُ اللّٰهِ تَعَالٰى عَلَيْهِ કે વાલિદે માજિદ
આંખેં બન્દ કિયે મુરાકબે મેં મશગૂલ થે કે અચાનક મરે હુવે સાંપ કા
એક ટુકડા આપ رَحْمَةُ اللّٰهِ تَعَالٰى عَلَيْهِ પર ઔર દૂસરા ટુકડા જમીન પર આ
ગિરા. આપ رَحْمَةُ اللّٰهِ تَعَالٰى عَلَيْهِ ને હજરતે સાબિરે પાક رَحْمَةُ اللّٰهِ تَعَالٰى عَلَيْهِ કી

ਵਾਲਿਦਾ ਕੋ ਉਸ ਮੁਦੂਰੀ ਸਾਂਪ ਕੀ ਜਾਨਿਬ ਮੁਤਵਜ਼ੇਹ ਕਿਧਾ, ਵੋਹ ਸਾਂਪ ਕੇ ਫੋ ਟੁਕੇ ਫੇਖ ਕਰ ਹੈਰਤ ਜਦਾ ਹੁੰਦਿ ਔਰ ਫਰਮਾਯਾ : ਕਿਆ ਮੈਂ ਘਵਾਬ ਫੇਖ ਰਹੀ ਹੁੰ ? ਹਜ਼ਰਤੇ ਸਾਧਿਦੁਨਾ ਅਲੀ ਅਹਮਦ ਸਾਬਿਰ ਰਖਨੇਤਾਲਿਲਾਹੁ تਾਗਲੁ عَلੀ ਨੇ ਵਾਲਿਦਾ ਕੀ ਤਸਵੀਰ ਫੂਰ ਕਰਤੇ ਹੁਵੇ ਫਰਮਾਯਾ : ਮੈਂ ਨੇ ਸਾਂਪਾਂ ਕੇ ਬਾਅਦਸ਼ਾਹ ਕੋ ਮਾਰ ਡਾਲਾ ਹੈ ਔਰ ਸਾਂਪਾਂ ਸੇ ਵਾਂਦਾ ਲਿਧਾ ਹੈ ਕਿ ਵੋਹ ਮੇਰੇ ਖਾਨਦਾਨ ਕੇ ਕਿਸੀ ਫੁੱਦ ਕੋ ਨਹੀਂ ਕਾਟੇਂਗੇ. ਲਿਖਾਂਗ ਆਜ ਸੇ ਕੋਈ ਸਾਂਪ ਮੇਰੇ ਖਾਨਦਾਨ ਕੇ ਕਿਸੀ ਫੁੱਦ ਕੋ ਨਹੀਂ ਕਾਟੇਗਾ।⁽¹⁾

ਤੀਨ ਸਾਲ ਮੌਤ ਵਿਖੇ ਝਾਹਿਰੀ ਕੀ ਤਕਮੀਲ

ਆਪ رਖਨੇਤਾਲਿਲਾਹੁ تਾਗਲੁ عَلੀ ਨੇ ਇੰਡਿਆਈ ਤਾਲੀਮ ਹਿਰਾਤ (ਅਫਗਾਨਿਸ਼ਤਾਨ) ਮੌਤ ਵਿਖੇ ਝਾਹਿਰੀ ਹਾਸਿਲ ਕੀ, ਫਿਰ ਜਥੁਂ ਆਪ رਖਨੇਤਾਲਿਲਾਹੁ ਤਾਗਲੁ عَلੀ ਕੇ ਵਾਲਿਦ ਸਾਭਿਖ ਕਾ ਇੰਜਿਕਲ ਹੋ ਗਿਆ ਤੋ ਆਪ ਕੀ ਵਾਲਿਦਾ ਨੇ ਆਪ ਕੋ ਅਪਨੇ ਭਾਈ ਹਜ਼ਰਤੇ ਬਾਬਾ ਫਰੀਦੁਦੀਨ ਮਸਤਿਹ ਗੰਡੇ ਸ਼ਕਤ ਕੇ ਸਿਪੁੱਦ ਕਰ ਦਿਧਾ. ਆਪ ਨੇ ਅਪਨੀ ਹੈਰਤ ਅੰਗੇਜ ਸਲਾਹਿਤ ਕੀ ਬਿਨਾ ਪਰ ਸਿੱਫ ਤੀਨ ਸਾਲ ਕੇ ਮੁੜਤਸਰ ਅੱਚੇ ਮੌਤ ਵਿਖੇ ਝਾਹਿਰੀ ਹਾਸਿਲ ਕਿਧੇ ਜੈਸਾ ਕਿ ਹਜ਼ਰਤੇ ਬਾਬਾ ਫਰੀਦ ਦੁਰਸ਼ਾਦ ਫਰਮਾਤੇ ਹੋਏ : ਅਲਾਉਦੀਨ ਅਲੀ ਅਹਮਦ ਸਾਬਿਰ رਖਨੇਤਾਲਿਲਾਹੁ ਤਾਗਲੁ عَلੀ ਨੇ ਤੀਨ ਸਾਲ ਮੌਤ ਵਿਖੇ ਅਰਥੀ ਵ ਫਾਰਸੀ ਕੀ ਕੁਤੁਬੇ ਮੁਤਦਾਵਲਾ, ਫਿਕਾਈ, ਹਫ਼ਿਜ਼, ਤਫ਼ਸੀਰ, ਮਨਿਤਕ ਵ ਮਾਨਾਨੀ ਵਗੈਰਾਈ ਉਲ੍ਲੇਬ ਕੀ ਤਕਮੀਲ ਕੀ. ਯੇਹ ਸਥਾਨ ਉਲ੍ਲੇਬ ਇਤਨੀ ਜਲਦੀ ਹਾਸਿਲ ਕਰ ਕਿਧੇ ਕਿ ਕੋਈ ਫੂਸਰਾ ਬਚਾ ਪਨਦਰਾਈ ਸਾਲ ਮੌਤ ਵਿਖੇ ਭੀ ਹਾਸਿਲ ਨਹੀਂ ਕਰ ਸਕਤਾ ਥਾ।⁽²⁾

① ਅਲਾਉਦੀਨ ਕੇ ਖਾਸ ਬਾਨੇ, ਸ. 575 ਮੁਲਾਖਸਨ

② ਹਜ਼ਰਤੇ ਮਖੂਸ ਅਲਾਉਦੀਨ ਅਲੀ ਅਹਮਦ ਸਾਬਿਰ ਕਲਾਯਰੀ, ਸ. 48

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! હજરતે સચ્ચિદુના અલાઉદીન
 અલી અહ્માદ સાબિર કલયરી રَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ પર **આલ્લાએ** કી
 ખુસૂસી રહમત થી કે આપ ને તીન સાલ કે મુખ્તસર અર્સે મેં કઈ
 ઉલ્ઘૂમે જાહિરી હાસિલ કિયે લેકિન અગર કોઈ કુન્દ જેણન હો તો
 ઉસે ભી ધબરાના નહીં ચાહિયે કયૂંકિ **આલ્લાએ** ને ઈન્સાન
 કો જો હિભત, અજ્રમ ઔર હૌસલા અતા ફરમાયા હૈ ઈસ કી
 બરકત સે કઈ મુશ્કલાત આસાન હો જાતી હૈને નીજ મેહનત,
 લગન ઔર મુસલસલ કોશિશ કી બરકત સે રાહ મેં હાઈલ તમામ
 રૂકાવટેં ખુદ હી હટતી ચલી જાતી હૈને જૈસા કિ સિલસિલાએ કાદિરિયા
 રજવિયા કે મશહૂર બુઝુર્ગ હજરતે સચ્ચિદુના જમાલુલ ઔલિયા
 કાદિરી عَلَيْهِ رَحْمَةُ اللَّهِ تَعَالَى કા હાઙ્ગિઝ પૈદાઈશી તૌર પર કાઝી કમજોર
 થા, ઈસી લિયે મદ્રસે કે તલબા આપ કા મગાંક ઉડાયા
 કરતે થે, જબ યેહ સિલસિલા મજીદ બઢા ઔર તલબા કે રવચ્ચે મેં
 જર્દ બારાબર તજ્જીલી નહીં આઈ તો આપ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ દિલ
 બરદાશ્તા હો કર જંગલ કી જાનિબ નિકલ ગાએ જબ આપ
 કો ગાઈબ હુવે તીન દિન ગુજર ગાએ તો આપ
 કે ઉસ્તાજ અલ્લામા કાજી જિયા જિયાઉદીન કાદિરી
 કો ફિક લાહિક હુદ્દ, વોહ આપ કી તલાશ મેં નિકલે
 ઔર હુંડતે હુવે ઉસી જંગલ મેં પહુંચ ગાએ, કયા દેખતે હૈને કે હજરતે
 સચ્ચિદુના જમાલુલ ઔલિયા કાદિરી رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ એક ગાર મેં ધુપે
 બેઠે હૈને. કાજી જિયા ને કરીબ જા કર મદ્રસા છોડને કી

વજહ મા'લૂમ કી તો આપ રَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ ને વજહ બયાન કરતે હુવે કહા : “તલબા મેરી કુન્દ જેણ્ણની પર હંસતે હોંં.” કાજી જિયા رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ ને જબ યેહ સુના તો જોશ મેં આ કર ઈરશાદ ફરમાયા : “ઉઠો ! મૈં ને તુમ્હેં ઝાહીન કર દિયા.”⁽¹⁾

હજરતે સચ્ચિદાનના કાજી જિયા رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કી મુખારક જબાન સે નિકલને વાલે યેહ કલિમાત બારગાહે ઈલાહી મેં મકબૂલ હુવે ઔર આપ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ ને ઝાહાનત ઔર કુવ્વતે હાફિઝા કી બદૌલત ફિકદ, ઉસ્સૂલે ફિકદ ઔર ઉલૂમે અરબિયા મેં મહારત હાસિલ કી ઔર આપ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કી કુવ્વતે હાફિઝા શોહરત કા સબબ બની. સારી જિન્દગી દર્સો તદરીસ મેં મશગૂલ રહે ઔર અવામો ખવાસ કી ઈલ્ભી ઘાસ કો બુઝાયા. હજરતે અલ્લામા મીર સચ્ચિદ મુહમ્મદ કાલપવી તિરમિઝી અલ હસની અબુલ ઉલાઈ કાદિરી, સાહિબે મુનાજિરએ રશીદિયા આલિમે કબીર હજરતે મૌલાના મુહમ્મદ રશીદ ઉસમાની જોનપુરી ઔર હજરતે સચ્ચિદાના મુલ્લા જીવન કે ઉસ્તાદ અલ્લામા લુત્ફુલ્લાહ કોરવી (رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِمْ) કા શુમાર આપ કે શાગિર્દો મેં હોતા હૈ. હજરતે સચ્ચિદાના જમાલુલ ઔલિયા કાદિરી عَلَيْهِ رَحْمَةُ اللَّهِ التَّقِيُّ સિલસિલાએ આલિયા કાદિરિયા કે મશાઈખ મેં સે હોંં.

ખાનએ હિલ કો જિયા દે રૂએ ઈમાં કો જમાલ
શહ જિયા મૌલા જમાલુલ ઔલિયા કે વાસિતે

صَلُوٰا عَلَى الْكَبِيْبِ! صَلُوٰا عَلَى الْكَبِيْبِ!

①તારીખે મશાઈખે કાદિરિયા, 2 / 90 માખૂજન

દાદા કી વફ્કાત કી પેશગી ખબર દે દી

બચપન મેં એક દિન હજરતે સાબિરે પાક રહ્મતુલ્લાહ તૃપુત્ર ને બાબા ફરીદુદ્ડીન ગંજે શકર રહ્મતુલ્લાહ તૃપુત્ર સે અર્જ કી : આજ સે તીન સાલ બા'દ મેરે દાદાજાન વિસાલ ફરમા જાયાંગે. યેહ સુન કર બાબા ફરીદ રહ્મતુલ્લાહ તૃપુત્ર ને ફરમાયા : બેટા ! આપ કે દાદા તો બગદાદ શરીફ મેં હું ઔર આપ યહાં ? (ફિર આપ કો કેસે મા'લૂમ હુવા કિ તીન સાલ બા'દ ઐસા હોગા) અર્જ કી : અભી મૈં ને અપને કલ્બ કી તરફ દેખા તો વાલિદ માજિદ કી સૂરત સામને આ ગઈ ઔર આપ ને સીધે હાથ કી તીન ઉંગલિયાં મેરી તરફ ઉઠાઈ ઔર યેહ (દાદાજાન કે) વિસાલ કા ઈશારા હૈ. હજરતે બાબા ફરીદુદ્ડીન ગંજે શકર રહ્મતુલ્લાહ તૃપુત્ર ને આપ કી ફિરાસત દેખ કર આપ રહ્મતુલ્લાહ તૃપુત્ર કો સીને સે લગા લિયા. ⁽¹⁾

ઓલિયા ભી ગૈબ જનતે હોય

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! ફેઝાને અમ્બિયાએ કિરામ عَلَيْهِمُ الرَّحْمَةُ وَالسَّلَامُ સે ઓલિયાએ ઉગ્રામ رَجُمُونُ اللَّهِ السَّلَامُ કો ભી ઈથે ગૈબ અતા કિયા જાતા હૈ ચુનાન્યે, ઈસ કિભન મેં અકાબિરીને ઉમ્મત કે અકવાલ મુલાહજા ફરમાઈયે :

(1) હજરતે અલ્લામા અલી કારી રહ્મતુલ્લાહ તૃપુત્ર શૈખે કળીર હજરતે અબૂ અખ્રુલ્લાહ શીરાજી રહ્મતુલ્લાહ તૃપુત્ર સે નકલ ફરમાતે હું : હમારા

①તાજકિરએ હજરતે સાબિર કલયર, સ. 36 મુલખસન

અકીદા હૈ કિ બન્દા તરકિક્યે મકામાત પા કર સિફતે રૂહાની તક પહુંચતા હૈ ઉસ વકત ઉસે ઈલ્મે ગૈબ હાસિલ હોતા હૈ. ⁽¹⁾

(2) સિલસિલાએ આલિયા નકશબન્ધિયા કે ઈમામ હજરતે સાખ્યદુના અગીજાન عَلَيْهِ رَحْمَةُ النَّبِيِّ ફરમાયા કરતે : “ઉસ ગુરૌહે ઔલિયા કી નજર મેં ઝમીન દસ્તર ખ્વાન કી તરણ હૈ.” ⁽²⁾ યા’ની જિસ તરણ દસ્તર ખ્વાન કી હર ચીજ નજર આ જાતી હૈ ઈસી તરણ ઝમીન કી હર ચીજ ઉન કો દિખાઈ દેતી હૈ. (3) હજરતે ખ્વાજા બહાઉલ હક્કે વદીન નકશબન્ધી عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْأَكْرَمِ યેહ કૌલ નકલ કર કે ફરમાતે : “હમ કહતે હું કિ (ઝમીન ઉન કે લિયે) નાખુન કી સત્તા કી તરણ હૈ, કોઈ ચીજ ઉન કી નજર સે ગાઈબ નહીં.” ⁽³⁾

(4) હમારે ગૌસે આ’જમ عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْأَكْرَمِ “કસીદાએ ગૌસિયા” મેં ફરમાતે હું :

**نَظَرُ إِلَىٰ بِلَادِ اللَّهِ جَمِعاً
كَخَزَنَةَ اللَّهِ عَلَىٰ حُكْمِ التَّصَالِي**

યા’ની મેં ને **આલાન ઉર્જા** કે સારે શહરોં કો ઈસ તરણ દેખ લિયા જેસે રાઈ કે ચન્દ દાને મિલે હુવે હોં.

(5) હજરતે સાખ્યદુના શૈખ અબુલ હક મુહદિસે દેહલવી عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْأَكْرَمِ ને અખારલ અખ્યાર મેં હુઝૂરે ગૌસે આ’જમ عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْأَكْرَمِ કા યેહ ઈરશાદ મુઅગ્લુમ નકલ કિયા હૈ : “અગર શરીઅત ને મેરે મુંહ મેં લગામ ન ડાલી હોતી તો મૈં તુમ્હેં બતા દેતા કિ તુમ ને ઘર મેં કયા

١... مِنْ قَدَّامَ الْمُفَاتِيحِ، كِتَابُ الْإِيمَانِ، الْفَصْلُ الْأَوَّلُ، ١٢٨/١، تَحْتُ الْحَدِيثِ ٢:

٢... تَفَثَّثُ الْأَنْسَ مُتَرْجِمٌ، ص ٢٨٧

٣... تَفَثَّثُ الْأَنْسَ مُتَرْجِمٌ، ص ٢٨٧

ખાયા હૈ ઔર ક્યા રખા હૈ ? મૈં તુમ્હારે ઝાહિરો બાતિન કો જાનતા હું કયુંકિ તુમ મેરી નજર મેં આર પાર નજર આને વાલે શીશે (યા'ની કાંચ) કી તરફ હો.”⁽¹⁾

(6) હજરતે ખ્વાજ મુઈનુદ્ડીન ચિશ્તી અજમેરી ફરમાતે હૈ : આરિઝોં કા મકામ બહુત બુલન્દ હૈ જબ વોહ ઉસ મકામ પર પહુંચ જાતે હૈં તો તમામ હુન્યા વ માફીહા (યા'ની જો કુછ હુન્યા મેં હૈ) કો અપની દો ઉગલિયોં કે દરમિયાન દેખતે હૈં.⁽²⁾

صَلُوٰ عَلَى الْحَبِيبِ ! صَلُوٰ عَلَى عَلِيٍّ مُحَمَّدٌ

મેરે દિલ કા ઈલ્મ અલાઉદ્ડીન કે પાસ હૈ

મીठે મીठે ઈસ્લામી ભાઈઓ ! દિલ તમામ જિસ્મ કા હાડિમ ઔર ઈલ્મો હિકમત કા સર ચશ્મા હૈ. ઈલ્મ કે નૂર સે દિલ કા મુનવ્વર હોના હુન્યા વ આખિરત દોનોં હી મેં કામયાબી કા ઝરીઆ હૈ. હજરતે સચ્ચિદુના અલી અહમદ સાબિર હજરતે બાબા ફરીદુદીન ગંજે શકર કે ફેઝાન સે ફેઝાબ હુવે ઔર આપ કે ઉલ્લૂમે કલ્બ કે વારિસ કરાર પાએ જૈસા કિ હજરતે બાબા ફરીદુદીન ગંજે શકર કે ફરીદુદીન ફરમાયા કરતે : મેરે સીને કા ઈલ્મ નિઝામુદ્ડીન (ઔવિયા) કે પાસ હૈ ઔર દિલ કા ઈલ્મ અલાઉદ્ડીન (અલી અહમદ સાબિર) કે પાસ હૈ.⁽³⁾

... أخبار الأخير، ١٥

... أخبار الأخير، ٢٣

③સિયરુલ અકતાબ મુતર્જમ, સ. 199 મુલખ્ખસન, ખજીનતુલ અરિઝ્યા મુતર્જમ, 2 / 153 મુલખ્ખસન, ઈક્તિતબાસુલ અન્વાર, સ. 498 મુલખ્ખસન.

ખિલાફત કી અગ્રીમુશશાન મહફિલ

રમજાનુલ મુખારક મેં બા'દ નમાજે તહજજૂદ હજરતે બાબા ફરીદુદ્વીન ગંજે શકર رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કુછ દેર કે લિયે આરામ ફરમા હુવે તો આપ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કી આંખ લગ ગઈ. આપ ને દેખા ક્રિએ એક ઐસે મકામે પુર અન્વાર મેં અપને પીરો મુર્શિદ હજરતે ખ્વાજા કુતબુદ્વીન બાંધિતયાર કાકી رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કે હમરાછ મૌજૂદ હું ક્રિ હર તરફ નૂર હી નૂર હૈ. એક આલીશાન દરબાર સજા હૈ નાભિયે રહમત, શરીરે ઉમ્મત صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ જલ્વા અફરોઝ હું. નીઝ સિલસિલાએ ચિશિતયા કે તમામ બુઝુર્ગ ભી હરથે મરાતિબ અપની અપની નિશસ્ત ગાહંઓ પર મૌજૂદ હું. હજરતે બાબા ફરીદ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કે પીરો મુર્શિદ હજરતે ખ્વાજા કુતબુદ્વીન બાંધિતયાર કાકી رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ ને હુકમ દિયા : મઘૂમ અલી અહમદ (સાબિર) કો આકાએ દો જહાં صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ કી બારગાહ મેં પેશ કીજિયે. આપ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ હરથે ઈરશાદ હજરતે સચિયદુના અલી અહમદ સાબિર કો બારગાહ રિસાલત મેં પેશ કર દિયા. આપ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ ને હજરતે સચિયદુના અલી અહમદ સાબિર رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કી પુશ્ત પર સીધે કન્યે કી જાનિબ બોસા દિયા ઔર ફરમાયા : “હન્ડા ઓ! اللَّهُ ઈસ કે બા'દ વહાં મૌજૂદ તમામ બુઝુર્ગોં ઔર મલાઈકા ને આપ દિયા ઔર યેહ કહા : “હન્ડા ઓ! اللَّهُ ફિર હર તરફ સે મુખારક બાદ કા સિલસિલા શુરૂઆ હો ગયા. ઇન મુખારક બાદ કી સદાઓં સે બાબા સાહિબ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કી આંખ ખુલ ગઈ.

અગલે રોજ હજરતે બાબા ફરીદુદ્ડીન ગંજે શકર રહેલું હતું કે એક આલીશાન મહફિલ કા ઈનઈકાદ ફરમાયા જિસ મેં હજરતે શૈખ અબુલ હસન શાજલી, હજરતે શૈખ હમીદુદ્ડીન નાગોરી, હજરતે શાહ મુનવ્વર અલી ઈલાહાબાદી, હજરતે શૈખ બહાઉદ્ડીન ઝકરિયા મુલ્તાની, હજરતે શૈખ અબુલ કાસિમ ગિરગાની (રહ્મતુલ્લહ તૈલી ઉલ્લેખ અન્યાની) વગેરા બડે બડે ઉલમા ઔર ઔલિયા શરીક હુંવે. ઈન તમામ ઔલિયાએ કિરામ (રહ્મતુલ્લહ તૈલી) કી મૌજૂદગી મેં હજરતે બાબા ફરીદુદ્ડીન ગંજે શકર ને અપના ઘ્વાબ બયાન ફરમાયા જિસે સુનતે હી વહાં મૌજૂદ તમામ બુજુગ્ગોં ને યકે બા'દ દ્વારા આપ (રહ્મતુલ્લહ તૈલી) કી મોહરે વિલાયત કો બોસા હિયા ઔર “હેડોલી લેડું કર મુખારક બાદ દી. ઈસ કે બા'દ હજરતે બાબા ફરીદુદ્ડીન ગંજે શકર ને શૈખ મઘૂમ (અલી અહમદ સાબિર (રહ્મતુલ્લહ તૈલી) કો ખાનદાને ચિશિત્યા કી ઈમામત વ જિલાફત અતા ફરમા કર અપને દસ્તે મુખારક સે અપની બા બરકત ટોપી પહનાઈ ઔર સબું સબું ઈમામે સે આપ (રહ્મતુલ્લહ તૈલી) કી દસ્તાર બન્દી ફરમાઈ ફિર કલયર શહર કી વિલાયત વ જિલાફત કી સનદ સબ હાજિરીને મહફિલ કો સુના કર આપ (રહ્મતુલ્લહ તૈલી) કો અતા ફરમાઈ. (1)

કલયર કી જિલાફત

હજરતે બાબા ફરીદુદ્ડીન ગંજે શકર રહેલું કિસી જબ કિસી કો જિલાફત અતા ફરમા કર કિસી અલાકે કી જાનિબ રવાના ફરમાતે
 ①તાજકિરણે હજરતે સાબિર કલયર, સ. 47 મુલભખસન

તો નસીહત કે મદની ઝૂલ ભી ઝડુર અતા ફરમાયા કરતે. હજરતે સાથ્યદુના અલી અહમદ સાબિર રહ્મતુલ્લહી તૃપુત્રુલ્લહી કો મુર્શિદ કી ઈસ અદા કા ઈલ્મ થા લિધાજા જબ આપ આપ રહ્મતુલ્લહી તૃપુત્રુલ્લહી ને કલયર જાને સે કળ્ય બારગાહે મુર્શિદ મેં અર્જ કી : બન્દ કે હક મેં ક્યા ફરમાન હૈ ? તો હજરતે બાબા ફરીદ રહ્મતુલ્લહી તૃપુત્રુલ્લહી ને ઈરશાદ ફરમાયા : “ક્રિન્દગી રાહત સે ગુજરેગી.” પસ આભિર ઉત્ત્ર તક આપ રહ્મતુલ્લહી તૃપુત્રુલ્લહી કી ક્રિન્દગી રાહત સે ગુજરી આપ બડે ખુશબાશ ઔર કુશાદા પેશાની થે. ⁽¹⁾

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! રાહે ખુદા મેં આને વાલી તકલીફોં ઔર મુશ્કલાત કો અલ્હાન ગુરૂજલ ગુરૂજલ કે નેક બન્દ રહમતે ઈલાહી ઔર રજ્બુલ અનામ ગુરૂજલ ગુરૂજલ કા ઈન્નામ સમજતે હૈન્ ક્ષ્યૂંકિ મુશ્કલાત પર સબ્ર કરને સે દરજાત બુલન્દ હોતે હૈન્, ઈસી લિયે બાબા ફરીદુદ્દીન ગંજે શકર રહ્મતુલ્લહી તૃપુત્રુલ્લહી ને આપ રહ્મતુલ્લહી તૃપુત્રુલ્લહી ૫૨ આને વાલી મુશ્કલાત કો રાહત કા સબબ કરાર દિયા.

કલયર આમદ

જબ આપ રહ્મતુલ્લહી તૃપુત્રુલ્લહી 10 ઝુલ હિજરી સિને 646 હિજરી યા સિને 650 હિજરી મેં 33 સાલ કી ઉત્ત્ર મેં કલયર તશરીફ લાએ તો યેહ એક અર્જિમુશાન ઔર બા રૌનક શહર થા. દૌલત કી ફિરાવાની, વસીઓ અરીજ ઈમારતેં ઔર મુજયન વ આરાસ્તા મકાનાત ને ઈસ શહર કો મરીદ ખૂબ સૂરત બના દિયા થા લેકિન ઈસ શહર કા જાહિર જિસ કદર રોશન થા ઈસ શહર કે મકીનોં કા બાતિન ઉસી કદર તારીક થા. યેહી વજહ હૈ કે યેહ લોગ હજરતે

¹મિરઆતુલ અસરાર, સ. 856 મુલખ્યસન

સચિયદુના અલી અહમદ સાબિર રહ્મતુલ્લહી તૃપતિ કે સાથ ઈન્તિહાઈ બદ સુલૂકી સે પેશ આગે. ⁽¹⁾

આજ યેહ સુણના ભી અદા હો ગઈ !

આપ રહ્મતુલ્લહી તૃપતિ કી તશરીફ આવરી વહાં કે કાજી કો એક આંખ ન ભાઈ. ઉસ ને આપ રહ્મતુલ્લહી તૃપતિ કે બિલાફ કલયર કે કિયામુદ્દીન નામી રઈસ કો વરગલાયા, રઈસ ભી કાજી કી બાતોં મેં આ ગયા. જબ હજરતે સચિયદુના અલી અહમદ સાબિર રહ્મતુલ્લહી તૃપતિ સે ઉસ રઈસ કા સામના હુવા તો ઉસ ને આપ રહ્મતુલ્લહી તૃપતિ સે કહા : “અગર આપ ઈમામત ઔર બિલાફત કે દા'વેદાર હું તો બતાઈયે મેરી તીન માણ સે ગાઈબ ખૂબ સૂરત ઔર કદ આવર સંજ રંગ વાલી બકરી કહાં હું ? અગર બતા દેંગે તો હમ આપ કો અપના ઈમામ માન કર આપ કી બૈઅત કર લેંગે.” આપ રહ્મતુલ્લહી તૃપતિ ને ઉસ રઈસ કી દસ્તગીરી ફરમાતે હુવે આલમે અરવાહ કી જાનિબ તવજજોહ ફરમાઈ ઔર હાથ ઉઠા કર ફરમાયા : “એ બકરી કે ખાને વાલો ! નિકલ આઓ.” લમ્હા ભર મેં વોહ તમામ કે તમામ લોગ આપ રહ્મતુલ્લહી તૃપતિ કી બારગાહ મેં હાજિર હો ગયે, આપ રહ્મતુલ્લહી તૃપતિ ઈરશાદ ફરમાયા : “તુમ લોગોં ને રઈસ કી બકરી પકડ કર ખા લી હું, ઈસ કી તફસીલ બયાન કરો.” રઈસ કે ખૌફ સે ઉન તમામ લોગોં ને ઈન્કાર કિયા તો આપ રહ્મતુલ્લહી તૃપતિ ને નમ્રા સે ઈરશાદ ફરમાયા : “બેહતર યેહી હું કિ ખુદ અપના અપના હાલ બયાન કર

¹મહફિલે ઔલિયા, સ. 383 મુલાખ્સન, હજરતે મઘૂમ અલાઉદીન અલી અહમદ સાબિર કલયરી, સ. 68 માખૂગન

દો વરના જરા સી દેર મેં પર્દા ફાશ હો જાએગા ઔર ફિર શર્મિન્દગી ઉઠાના પડેગી.” યેહ સુન કર ભી વોહ લોગ મુસલસલ ઈન્કાર હી કરતે રહે તો આપ રહ્માનુલ્લહ તૃતીય ને રઈસ સે ઈરશાદ ફરમાયા : આપ અપની બકરી કા નામ પુકારિયે. કૈસે હી ઉસ ને “હરમના” કહ કર આવાજ દી તો બકરી કો હડપ કર જાને વાલોં કે પેટ સે યેહ આવાજ આઈ : “મૈં હન લોગોં કે પેટ મેં હું, ઈન્ધોંને આધી રાત કો ચાહે સદરક કે કનારે પર ઝબ્બ કર કે મેરા ગોશ્ટ ભૂન કર ખાયા થા ઔર હઙ્કિયાં, ખાલ મેં રખ કર કુંઘેં મેં ફેંક દી હું.” યેહ સુન કર રઈસ ને અર્જ કી : “આપ બેશક અક્તાબ મેં સે હું !” આગે બઢ કર બૈઅત કરના હી ચાહતા થા કિ કાજી ને ઉસે રોક લિયા ઔર ઉસ કે કાન મેં કહા : “ઈસ કે ધોકે મેં મત આના યેહ બહુત બડા જાદૂગર મા’લૂમ હોતા હૈ.” યેહ સુન કર રઈસ કા દિલ લમ્છા ભર મેં પલટ ગયા, ઉસ કે કદમ રૂક ગએ ઔર ઈસ કદર રોશન કરામત દેખને કે બા વુજૂદ જબાન સે બદ ગુમાની કે ઝદ્દર મેં બુઝા હુવા તીર નિકલા : “મુઝે તો તુમ કુતુબ નહીં જાદૂગર લગતે હો !” યેહ સુન કર હજરતે સચ્ચિદુના અલી અહમદ સાબિર રહ્માનુલ્લહ તૃતીય મુસ્કુરા દિયે ઔર અફવો દર ગુજર કી મા’નવી કરામત કા ઈજહાર કરતે હુવે યું ફરમાયા : આજ આજ યેહ સુન્નતે નબવી ભી અદા હો ગઈ કિ મુઝે જાદૂગર કહા ગયા.⁽¹⁾

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! હજરતે સચ્ચિદુના અલી અહમદ સાબિર કલયરી રહ્માનુલ્લહ તૃતીય કી મુબારક સીરત મેં નેકી કી દા’વત કી ધૂમેં મચાને વાલે મુખલિલગીન કે લિયે એક મદની કૂલ યેહ ભી હૈ કિ

¹તાજકિરાએ હજરતે સાબિર કલયર, સ. 59 મુલખ્ખસન

નેકી કી દા'વત મેં જિસ કદર આજમાઈશેં આઈ ઉન કા મુકાબલા કરને કે લિયે ખારે ખારે આકા, મદ્દાને વાલે મુસ્તફા صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

પર આને વાલી આજમાઈશોં કો યાદ કીજિયે ક્યૂંકિ ઈસ કી બરકત સે હૈસલા પસ્ત નહીં હોગા ઔર ન હી શૈતાન ઈસ રાહ મેં રૂકાવટ બન સકેગા।

અલ્લાહ ગુર્જાલ કે વલી કી દિલ આગારી કા અન્જામ

જબ હજરતે સાચ્છિદુના અલી અહમદ સાબિર કલયરી રહ્મતુલ્લહ તશરીફ લાએ ઉસ વક્ત વહાં દૌલત મન્દ ઉમરા કી એક બડી તા'દાદ આબાદ થી, જુમુએ કી અદાએગી કે લિયે યેહ ઉમરા હાથિયોં પર સુવાર હો કર મસ્ઝિદ આતે ઔર અપને ગુરુર વ તકબુર કી તસ્કીન કે લિયે અવ્યલીન સફોં મેં હી બૈઠના પસન્દ કરતે, કિસી ગરીબ વ મિસ્કીન કો મજાલ ન હોતી કિ ઈન સફોં મેં બૈઠ જાએ અગર કોઈ ગલતી સે બૈઠ ભી જાતા તો ઉસે ડરા ધમકા કર પીછે કર દિયા કરતે, યેહ લોગ ગરીબોં કો અપના ગુલામ સમજતે થે યેહી કેફિયત શહર કે કાજી વ હાકિમ કી ભી થી. આપ રહ્મતુલ્લહ તશરીફ ને ઈન કી ઈસ્લાહ કે લિયે ખૂબ કોશિશ ફરમાઈ લેકિન હાકિમ વ ઉમરા દૌલત કે નશે મેં ચૂર થે ઔર શહર કે કાજી કો અપના મન્સબ છિન જાને કા ખૌફ થા ઈસ વજદ સે ઈન દોનોં તબકોં ને ઈસ્લાહ ખુશાદિલી સે કબૂલ કરને કે બજાએ આપ રહ્મતુલ્લહ કા મળાક ઉડાના શુરૂઆ કર દિયા.

હજરતે સાચ્છિદુના અલી અહમદ સાબિર કલયરી રહ્મતુલ્લહ તશરીફ નમાઝ વક્તા નમાઝે બા જમાઅત કી આદત તો બચપન હી સે થી, જબ આપ રહ્મતુલ્લહ કલયર તશરીફ લાએ તબ ભી તમામ તર

આજમાઈશોં ઔર મુશ્કિલાત કે બા વુજ્હું મસ્ઝિદ કી હાજિરી કી ખારી ખારી આદત બર કરાર રહી. જબ જુમુઆ આયા તો આપ નમાજે જુમુઆ કી અદાએગી કે લિયે મસ્ઝિદ તશરીફ લાએ ઔર પહલી સફ મેં જલ્વા અફરોઝ હો ગએ, હરબે મા'મૂલ રૂઅસા ઔર ઉમરા ને આપ રહ્મતુલ્લહ કો સફે અવ્યલ સે મહરૂમ કર દિયા, જબ દૂસરે ઔર તીસરે જુમુએ ભી પહલી સફ સે મહરૂમી કા સિલસિલા હુવા તો આપ રહ્મતુલ્લહ ને અપને પીરો મુર્શિદ બાબા ફરીદુદ્ડીન ગંજે શક્ર રહ્મતુલ્લહ કો મકતૂબ કે જરીએ તમામ અહવાલ સે આગાહ ફરમાયા, મુર્શિદ ને જવાબી મકતૂબ મેં યેહ ઈરશાદ ફરમાયા : “કલયર તુમ્હારી બકરી હૈ તુમ્હેં ઈજાજત હૈ દૂધ પિયો યા ગોશ્ઠ ખાઓ.” યેહ ઈજાજત પા કર જબ આપ ચૌથે જુમુએ મસ્ઝિદ કી પહલી સફ મેં તશરીફ ફરમા હુવે તો એક બાર ફિર ઉમરા ને આપ કો પીછે તશરીફ લે જાને પર મજબૂર કર દિયા, ઈસ બાર આપ રહ્મતુલ્લહ મસ્ઝિદ સે બાહર તશરીફ લાએ ઔર ઈરશાદ ફરમાયા : “એ મસ્ઝિદ ! ઈમામ તો અપના કામ ખત્મ કર ચુકા ઔર તૂ અભી તક ખડી હૈ ! તૂ ભી સજદા કર.” જબાને મુખારક સે યેહ અલ્જાજ અદા હોતે હી મસ્ઝિદ કી છત ગિર ગઈ ઔર વલિયુલ્હાહ કો સફે અવ્યલ સે મહરૂમ કર કે દિલ આજારી કરને વાલે મુતકબિબર ઉમરા અપને અન્જામ કો પહુંચે. (૧)

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! મા'લૂમ હુવા કિ **અલ્લાહ** ગ્રેજુલ કે ઔલિયા કી ગુસ્તાખી તબાહી વ બરબાદી કા સબબ બન

(૧)મહફિલે ઔલિયા, સ. 383,384 મુલાખ્સસન, ખજીનતુલ અસ્ફિયા, 2 / 155 માખૂજન, **અલ્લાહ** કે ખાસ બન્દે, સ. 584 મુલાખ્સસન

જાતી હૈ, લિહાજા કભી ભી કિસી નેક બન્દે બલિક આમ મુસલમાન કી ભી હિલ આજારી મત કીજિયે. હર ઈસ્લામી ભાઈ કો ચાહિયે કિ પહોંચી કુરસત મેં અપને ઘર બાર, અગ્રીજો અકારિબ, મહલ્લા દારોં, માર્કેટ યા દફૃતર મેં સાથ કામ કરને વાલોં, સાથ પઠને વાલોં અલ ગરજ જિન જિન સે ઉસ કા વાસિતા પડતા હૈ, ઉન કે બારે મેં દિયાનત દારી કે સાથ સોચે કિ ઉન કી ગીબત, ચુગલ ખોરી, હક તલફી ઔર હિલ આજારી કા સિલસિલા તો નહીં ? અગર ઈન સુવાલાત કા જવાબ હાં મેં મિલે તો ફૌરન તૌબા કીજિયે ઔર આઈન્દા કે લિયે યેહ નિયત ભી કરે કિ અગર મેરી વજહ સે કિસી મુસલમાન કી હિલ આજારી હો ગઈ તો ઉસી વક્ત આજિઝી કે સાથ મુઆફી ભી માંગુંગા. **إِنْ شَاءَ اللَّهُ عَزَّ وَجَلَّ**

صَلُوٰعَلَى الْحَبِيبِ ! صَلُوٰعَلَى الْحَبِيبِ !

અદ્વ વ મા'બૂદ કે માબૈન ફર્ક

હજરતે સાધ્યદુના અલી અહ્મદ સાબિર કલયરી રહ્મતુલ્લાહ રહ્મતુલ્લાહ અકસર ફરમાતે : બન્દે ઔર **અલ્લાહ** કે માબૈન યેહ ફર્ક હૈ કિ બન્દા ખાને કા મોહતાજ હૈ ઔર ખુદા ઈસ સે મુનજૂજા વ પાક હૈ. (1)

નમાજ સે મહિબત

આપ રહ્મતુલ્લાહ રહ્મતુલ્લાહ કો નમાજ સે બેહદ મહિબત થી ઔર ઈસ મહિબત કી વજહ આપ રહ્મતુલ્લાહ રહ્મતુલ્લાહ ને યેહ બયાન ફરમાઈ : નમાજ ભી ક્યા અચ્છી ચીજ હૈ કિ હુઝૂરી (કી બરકત) સે દરબાર

①તાજકિરએ હજરતે સાબિર કલયર, સ. 83 મુલખસન

(યા'ની દરબારે ઈલાહી) મેં લે આઈ હૈ (યા'ની નમાજ દરબારે ઈલાહી મેં હજરી કા સબબ બનને કી વજહ સે ઉમદા ઈબાદત હૈ). ⁽¹⁾

લિબાસ

આપ رَحْمَةُ اللّٰهِ تَعَالٰى عَلَيْهِ કા લિબાસ કુર્તા, તહબન્દ ઔર ઈમામા શરીફ પર મુશ્તમિલ હુવા કરતા. ⁽²⁾

ગા ઈમામા રહણા અકલમન્દી કી અલામત હે

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! ઈમામા શરીફ સર કી જીનત, પાબન્ધિયે સુન્તત કી પહ્યાન, મોભિન કી આન બાન ઔર ઉલમા, કુકળ વ બુગુગને સલફ વ ખલફ કી શાન હૈ ઈસે છોડના સબબે નુક્સાન હૈ જબ કિ નંગે સર રહને કી આદત, નંગે સર રાસ્તો મેં ચલના ઔર ઈસી તરફ મસાજિદ મેં નમાજ કે લિયે દાખિલ હો જાના અથી આદત નહીં. ઉલમા વ સુલહા તો સર ઢાંપ કર રહતે હી થે, આમ શુરફા ભી ઈસે તહજીબ ઔર શરાફત કા હિસ્સા સમજતે યેહી વજહ હૈ કિ હજરતે અલ્લામા ઈબ્ને જૌગી رَحْمَةُ اللّٰهِ تَعَالٰى عَلَيْهِ ફરમાતે હૈન : અકલમન્દ આદમી સે યેહ બાત પોશીદા નહીં હૈ કિ નંગે સર રહના અથી આદત નહીં, ક્યૂંકિ ઈસ મેં તર્ક અદબ ઔર મુરવ્વત કી બિલાફ વર્જી પાઈ જાતી હૈ. ⁽³⁾ સર ઢાંપને કી કિસ કદર અહિમિયત હૈ ઈસ કા અન્દાજા ઈસ રિવાયત સે બ ખૂબી લગાયા

①તહજીરએ હજરતે સાબિર કલયર, સ. 82 મુલખસન

②હજરતે મહૂમ અલાઉદીન અલી અહમદ સાબિર કલયરી, સ. 80 મુલતકતન

٣ . . تلييس أبييس، الباب العاشر في ذكر تلييس على الصوفية الخ، قصل في ذكر الأدلة على كراهة الغناوة من

જો સકતા હૈ ચુનાન્યે હજરતે વાસિલા બિન અસ્કામ રَبِّ الْمُلْكُ عَزَّوَجَلَّ ફરમાતે હૈને : “દિન મેં સર ઢાંપના અકલમન્દી હૈ.”⁽¹⁾ લિહાજા હમેં ભી ચાહિયે ન સિર્જ નમાજ કે વક્ત અપને રબ કે હુગ્ગૂર સર ઢાંપ કર હાજિર હોં બલિક હર વક્ત હી ઈમામા શરીર સજાએ રખેં કિ ઈસ કી બડી બરકતે હૈને જૈસા કિ

મુર્દબાર બનને કા આસાન અમલ

હજરતે સાચિદુના ઈન્ને અભ્યાસ રિવાયત કરતે હૈને : રસૂલુલ્લાહ ﷺ ને ફરમાયા : صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ إِعْتَدُوا تَرْذَادُوا حِلْمًا યાની ઈમામા બાંધો તુમ્હારા હિલ્મ બઢેગા.⁽²⁾

હજરતે અલ્લામા અબ્દુર્રાજિઝ મનાવી ઈસ હટીસે પાક કે તથૃત ફરમાતે હૈને : (ઈમામા બાંધો) તુમ્હારા હિલ્મ બઢેગા ઔર તુમ્હારા સીના કુશાદા હોગા ક્યૂંકિ જાહિરી વળ્ણાં કર્તાં કા અચ્છા હોના ઈન્સાન કો સંચાદા ઔર બા વકાર બના દેતા હૈ નીજ ગુસ્સે, જગ્ઘબાતી પન ઔર ખસીસ હરકાત સે બચાતા હૈ.⁽³⁾

આપ કી ગિઝા

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! ગિઝા ઈન્સાન કે જાહિરો બાતિન દોનોં પર અસર કરતી હૈ યેહી વજહ હૈ કિ હમારે બુગુગાને દીન (رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِمْ أَجْمَعِينَ) નિહાયત હી સાદા ગિઝા પર કનાયત કિયા કરતે. દર અસ્લ યેહ હજરાત ખાને કે લિયે નહીં જીતે બલિક

... ١-كتاب العمال،كتاب المعيشة والعادات،فرع في العمام،جزء: ١٥، ١٣٣: ٨، حديث: ١١٣٢ مختصر

... ٢-معجم كبار،عبد الله بن العباس، ١٤١: ١٢٩٣، حديث: ١٢٩٣

... ٣-فيض القديرين،حرف الهمزة، ١: ٥٠٦، تحت الحديث: ١١٢

જીને કે લિયે ખાના તનાવુલ ફરમાતે. હજરતે સચ્ચિદાનંદના અલી અહુમદ સાબિર રહેણે એકસર રોજે સે રહતે, આપ રહેણે એકસર પાની મેં ઉભલા હુવા બે નમક ગૂલર⁽¹⁾ તનાવુલ ફરમાતે, બસ યેહ હી આપ રહેણે એકસર કી ખાસ ગિજા થી.⁽²⁾

અમીરે અહલે સુન્નત બાનિયે દા'વતે ઈસ્લામી હજરતે અલ્લામા મૌલાના અભૂ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અત્તાર કાદિરી રજવી અપની માયાનાજ તાલીફ ફેઝાને સુન્નત મેં ફરમાતે હૈન :

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! ખાના કમ ખાને કે સાથ સાથ બિલ ખુસૂસ મૈદા, મિઠાસ વ ચિકનાહટ ઔર ઈસ કી બનાવટો કે ઈસ્તિ'માલ મેં (તબીબ કે મશવરે કે મુતાબિક) કમી રખને સે બદન કે વજ્ઞન મેં કમી આતી, ઉભરા હુવા પેટ અસ્થી હાલત પર આતા ઔર આદમી ખુશ અન્દામ (યા'ની SMART) રહતા હૈ. કમ ખાને વાલે હલ્કે બદન વાલે મુસલમાન કો ખુદાએ રહમાન ગૂજીં પસન્દ ફરમાતા હૈ ચુનાન્યે, હજરતે સચ્ચિદાનંદ ઈન્ને અજબાસ રહેણાના સે રિવાયત હૈ કિ નબિયે કરીમ, રડીકુરહીમ અલ્લાહ કો તુમ મેં સબ સે જિયાદા વોહ બન્દા પસન્દ હૈ જો કમ ખાને વાલા ઔર ખફીફ (યા'ની હલ્કે) બદન વાલા હૈ.⁽³⁾

①.....અન્ધર કી તરફ કા એક રૂઘેદાર ફલ હૈ. ઈસે છિન્દી મેં ગૂલર ઔર અંગ્રેજી મેં Wild Figs કહતે હૈન . કચ્ચે ફલ કા રંગ સબજ જબ કિ પકે હુલે કા સુર્ખ હોતા હૈ . (કિતાબુલ મુફરિદાત, સ. 424)

②.....સિયરલ અકતાબ મુતર્જમ, સ. 200 મુલાખ્સન, સિફતુલ કામિલીન, સ. 141

٢٢١: حديث: ص ٢٠... الجامع الصغير

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! અમલ કા જગ્ઘબા બઢાને કે લિયે
મદની માહોલ જરૂરી હૈ, વરના આરિજી તૌર પર જગ્ઘબા પૈંડા હોતા
ભી હૈ તો અથી સોહબત કે કુફદાન (યા'ની કમી) કે સબબ ઈસ્તિકામત
નહીં મિલ પાતી. લિહાજા આશિકાને રસૂલ દી સોહબત હાસિલ કરને
કે લિયે મદની કાંડિલોં મેં સફર કો અપના મા'મૂલ બના લીજિયે.

الحمد لله رب العالمين
દી ધૂમ ધામ હૈ. આઈયે દા'વતે ઈસ્લામી દી એક ઈમાન અફરોજ
“બહાર” સે અપને કલ્યો જિગર કો ગુલે ગુલાર કીજિયે. ચુનાન્યે,

એક ગૈર મુસ્લિમ કા કબૂલે ઈસ્લામ

તહસીલ ટાંડા જિલ્લા આમ્બેડકર નગર (યુપી હિન્દ) કે એક
ઈસ્લામી ભાઈ કા કુછ ઈસ તરહ બયાન હૈ : મૈં કુઝ કી તારીક
વાદ્યોં મેં ભટક રહા થા, એક દિન કિસી ને મકતબતુલ મદીના કા
એક રિસાલા એહતિરામે મુસ્લિમ તોડુકે મેં હિયા મૈં ને પઢા તો હેરત
જદા રહ ગયા ક્રિ જિન મુસલમાનોં કો મૈં ને હમેશા નફરત કી
નિગાહ સે દેખા હૈ ઉન કા મજહબ “ઈસ્લામ” આપસ મેં ઈસ કદર
અભો આશી કા પયામ દેતા હૈ ! રિસાલે કી તહીરીર તાસીર કા તીર
બન કર મેરે જિગર મેં પૈવસ્ત હો ગઈ ઔર મેરે દિલ મેં ઈસ્લામ કી
મહિબ્બત કા ચશમા મોજેં મારને લગા. એક દિન મૈં બસ મેં સફર કર
રહા થા ક્રિ ચન્દ દાઢી ઔર ઈમામે વાલે ઈસ્લામી ભાઈયોં કા કાંડિલા
ભી બસ મેં સુવાર હુવા, મૈં દેખતે હી સમજ ગયા ક્રિ યેહ મુસલમાન

ਹੈਂ, ਮੇਰੇ ਵਿਲ ਮੌਂ ਈਸ਼ਵਾਮ ਕੀ ਮਹੱਭਤ ਤੋ ਪੈਂਦਾ ਹੋ ਹੀ ਚੁਕੀ ਥੀ ਲਿਹਾਜਾ ਮੈਂ ਅਖਤਿਰਾਮ ਕੀ ਨਜ਼ਰ ਸੇ ਉਨ ਕੋ ਫੇਖਨੇ ਲਗਾ, ਈਤਨੇ ਮੌਂ ਉਨ ਮੌਂ ਸੇ ਏਕ ਈਸ਼ਵਾਮੀ ਭਾਈ ਨੇ ਨਭਿਧੇ ਪਾਕ ﷺ ਕੀ ਸ਼ਾਨ ਮੌਂ ਨਾ'ਤ ਸ਼ਰੀਫ ਪਛਨੀ ਸ਼ੁਰੂਆਤ ਕਰ ਦੀ, ਮੁੜੇ ਉਸ ਕਾ ਅਨੰਦਾਜ ਬੇਹਦ ਭਲਾ ਲਗਾ, ਮੇਰੀ ਵਿਲਚਾਸਪੀ ਫੇਖ ਕਰ ਉਨ ਮੌਂ ਸੇ ਏਕ ਨੇ ਮੁੜ ਸੇ ਗੁਫ਼ਟਾਗੂ ਸ਼ੁਰੂਆਤ ਕਰ ਦੀ ਵੋਡ ਸਮਜ ਗਿਆ ਕਿ ਮੈਂ ਮੁਸਲਮਾਨ ਨਹੀਂ ਹੁੰ, ਉਸ ਨੇ ਬੇਦੇ ਵਿਲ ਨਥੀਨ ਅਨੰਦਾਜ ਮੌਂ ਮੁੜ ਸੇ ਕਹਾ : “ਮੈਂ ਆਪ ਕੋ ਈਸ਼ਵਾਮ ਕਬੂਲ ਕਰਨੇ ਕੀ ਦਰਖਵਾਸਤ ਕਰਤਾ ਹੁੰ.” ਰਿਸਾਲਾ ਅਖਤਿਰਾਮੇ ਮੁਸਲਿਮ ਪਠ ਕਰ ਮੈਂ ਚੂਂਕਿ ਪਛਲੇ ਹੀ ਵਿਲੀ ਤੌਰ ਪਰ ਈਸ਼ਵਾਮ ਕਾ ਗਿਰਵੀਦਾ ਹੋ ਚੁਕਾ ਥਾ. ਉਸ ਕੇ ਆਜਿਹਾ ਅਨੰਦਾਜ ਨੇ ਵਿਲ ਪਰ ਮਜ਼ੀਦ ਅਤੇ ਰਾਤਾ, ਮੁੜ ਸੇ ਈਨਕਾਰ ਨ ਬਨ ਪਤਾ, ﴿الْحَمْدُ لِلّٰہِ عَزَّوَجَلَّ﴾ ਮੈਂ ਨੇ ਸਾਥੇ ਵਿਲ ਸੇ ਈਸ਼ਵਾਮ ਕਬੂਲ ਕਰ ਲਿਆ. ﴿الْحَمْدُ لِلّٰہِ عَزَّوَجَلَّ﴾ ਯੇਹ ਬਧਾਨ ਫੇਤੇ ਵਕਤ ਮੁਸਲਮਾਨ ਹੁਵੇ ਮੁੜੇ ਚਾਰ ਮਾਝ ਹੋ ਚੁਕੇ ਹੈਂ, ਮੈਂ ਪਾਖਨਦੀ ਸੇ ਨਮਾਜ ਪਠ ਰਹਾ ਹੁੰ, ਢਾਢੀ ਸਜ਼ਾਨੇ ਕੀ ਨਿਧਤ ਕਰ ਲੀ ਹੈ, ਦਾ'ਵਤੇ ਈਸ਼ਵਾਮੀ ਕੇ ਮਦਨੀ ਮਾਹੋਲ ਸੇ ਵਾਅਸਤਾ ਹੋ ਕਰ ਮਦਨੀ ਕਾਫ਼ਿਲੋਂ ਮੌਂ ਸਫਰ ਕੀ ਸਾਂਘਾਤ ਭੀ ਪਾ ਰਹਾ ਹੁੰ. ⁽¹⁾

ਕਾਫ਼ਿਰਾਂ ਕੋ ਚਲੋ ਮੁਸ਼ਾਰਿਕਾਂ ਕੋ ਚਲੋ ਦਾ'ਵਤੇ ਦੀਨ ਵੱਡੇ ਕਾਫ਼ਿਲੇ ਮੌਂ ਚਲੋ
ਦੀਨ ਫੇਲਾਈ ਸਥ ਚਲੋ ਆਈ ਮਿਲ ਕੇ ਸਾਰੇ ਚਲੋ ਕਾਫ਼ਿਲੇ ਮੌਂ ਚਲੋ

ਮੇਹਮਾਨੋਂ ਕੀ ਐਰ ਘਵਾਹੀ ਫਰਮਾਤੇ

ਹਤਾਰੇ ਸਥਿਦ ਅਲਾਉਦੀਨ ਅਲੀ ਅਤਮਦ ਸਾਬਿਰ

ਪਾਨੀ ਮੌਂ ਉਥਲੇ ਹੁਵੇ ਗੂਲਰ ਪਸਨਦ ਫਰਮਾਤੇ ਲੇਕਿਨ ਜਥੁ ਮਹੱਭੂਬੇ ਈਲਾਹੀ

¹.....ਫੇਜਾਨੇ ਸੁਨਨਾ, 1 / 258

હજરતે સચ્ચિદ મુહમ્મદ નિઝામુદ્ડીન ઔલિયા રહ્મતુલ્લહ તૃપુરુષ કે યહાં સે કોઈ શખ્સ આતા તો આપ રહ્મતુલ્લહ તૃપુરુષ ખુદામ સે ફરમાતે : ભાઈ ! યેહ દેહલી સે આએ હોય, ઈન કે ખાને મેં નમક જરૂર શામિલ કરના. ⁽¹⁾

જિન્દગી કે હર પહ્લુ સે સબુ ગલકતા

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! હજરતે સચ્ચિદુના અલી અહમદ સાબિર કલયરી રહ્મતુલ્લહ તૃપુરુષ કમ ખાતે, કમ ગુફત્ગૂ ફરમાતે ઔર કમ સોતે, આપ રહ્મતુલ્લહ તૃપુરુષ જિયાદા તરતાઈ મેં રહ કર અલ્લાહ عَزَّوَجَلَّ કી ઈબાદત મેં મસરૂફ રહા કરતે ઔર બા'જ ઔકાત કઈ કઈ દિન તક ફાંકે સે રહ કર નફસ કી ખૂબ તરબિયત ફરમાતે. હમેશા અમીન પર સોતે થે ઔર બિધૌના વગેરા કુદ્દ ન બિધાતે. ⁽²⁾

આપ રહ્મતુલ્લહ તૃપુરુષ કી યેહ તમામ આદાત ઈસ બાત કી દલીલ હોય કી આપ રહ્મતુલ્લહ તૃપુરુષ કી મુખારક જાત સરાપા સબુ થી. સબુ કી યેહ અજીમ દૌલત હું મેં ભી હાસિલ હો સકતી હૈ, લેકિન ઈસ કે લિયે મુસલસલ કોશિશ જરૂરી હૈ. અગર આપ ભી સબુ કી અમલી તરબિયત હાસિલ કરના ચાહતે હોય તો ઈન મદની ફૂલોં પર અમલ કીજિયે :

(1) સબુ કે ફાજાઈલ પેશો નજર રખિયે

કિસી ભી નેક કામ યા અણે અમલ કે ફાજાઈલ પેશો નજર હોય તો ઉસ પર અમલ કરના આસાન હો જાતા હૈ. સબુ તો વોહ

¹સિયરુલ અકતાબ મુતરજીમ, સ. 200

²અલ્લાહ કે ખાસ બન્દે, સ. 576 મુલખસન, હજરતે મઘૂમ અલાઉદીન અલી અહમદ સાબિર કલયરી, સ. 80 મુલખસન

ਬਾਤਿਨੀ ਖੂਬੀ ਹੈ ਕਿ ਜਿਸ ਕੇ ਫ਼ਾਈਲ ਸੇ ਕੁਰਾਅਨੋ ਹਫ਼ਟਿਸ ਮਾਲਾ ਮਾਲ ਹੋਣੇ, ਸਾਬਿਰੀਨ ਕੇ ਲਿਧੇ ਬਡਾ ਈਨਾਮ “**ਅਲਲਾਹ** **غੰਗ਼ੋਂ** ਕਾ ਸਾਥ” ਹੈ ਯੁਨਾਨੀ, **ਅਲਲਾਹ** **غੰਗ਼ੋਂ** ਈਰਸਾਦ ਫਰਮਾਤਾ ਹੈ : **إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ** “**ਅਲਲਾਹ** **ਸਾਬਿਰਾਂ** ਕੇ ਸਾਥ” (۱) ਧੇਹ ਤਜ਼ਮਾਨੇ ਕਨ੍ਜੁਲ ਈਮਾਨ : ਬੇਸ਼ਕ **ਅਲਲਾਹ** **ਸਾਬਿਰਾਂ** ਕੇ ਸਾਥ ਹੈ। ਧੇਹ ਔਰ ਈਸ ਤਰਛ ਕੇ ਵੀਗਰ ਫ਼ਾਈਲ ਜੇਹੜਨ ਨਥੀਨ ਕਰ ਲੇਨੇ ਸੇ ਬਡੀ ਸੇ ਬਡੀ ਆਜਮਾਈ ਕਾ ਮੁਕਾਬਲਾ ਕਰਨਾ ਆਸਾਨ ਹੋ ਜਾਂਦਾ ਹੈ।

(2) ਬਾਰਗਾਹੇ ਇਲਾਹੀ ਮੌਦੂਦ ਦੁਆ ਕੀਤਿਯੇ

ਆਜਮਾਈ ਹਮੇਂ **ਅਲਲਾਹ** **ਗੰਗ਼ੋਂ** ਦੇ ਤਅਲਲੁਕ ਕਾਈਮ ਕਰਨੇ, ਉਸ ਕੀ ਬਾਰਗਾਹ ਮੌਦੂਦ ਦੁਆ ਕਰਨੇ ਕਾ ਸਬਦ ਬਨਤੀ ਹੈ ਔਰ ਜਬ ਈਸ ਕੇਝਿਧਤ ਮੌਦੂਦ ਆਹੋ ਜਾਰੀ ਕਰ ਕੇ **ਅਲਲਾਹ** **ਗੰਗ਼ੋਂ** ਕੀ ਬਾਰਗਾਹ ਮੌਦੂਦ ਦੁਆ ਕਰਤਾ ਹੈ ਤੋ ਉਸ ਕੀ ਦੁਆ ਜੜੇ ਮਕਬੂਲ ਹੋਤੀ ਹੈ ਲਿਹਾਜਾ ਜਬ ਭੀ ਕੋਈ ਮੁਸੀਬਤ ਦਰਪੇਸ਼ ਹੋ ਤੋ **ਅਲਲਾਹ** **ਗੰਗ਼ੋਂ** ਦੇ ਸਥਾਨ ਪਰ ਇਨਿਤਕਾਮਤ ਔਰ ਉਸ ਆਜਮਾਈ ਕੇ ਖਤਮ ਹੋ ਜਾਂਦੇ ਕੀ ਦੁਆ ਕੀਤਿਯੇ।

(3) ਆਜਿਝੀ ਅਪਨਾ ਲੀਕਿਯੇ

ਮੀਠੇ ਮੀਠੇ ਈਸਲਾਮੀ ਭਾਈਧੀ ! ਧੇਹ ਬਾਤ ਜੇਹੜਨ ਨਥੀਨ ਕਰ ਲੀਕਿਯੇ ਕਿ ਤਕਬੂਰ ਵੀਛ ਬਰਤਨ ਹੈ ਜਿਸ ਮੌਦੂਦ ਸਥਾਨ ਕਾ ਸ਼ਹਦ ਕਭੀ ਭੀ ਨਹੀਂ ਸਮਾ ਸਕਤਾ ਲਿਹਾਜਾ ਅਗਰ ਆਪ ਅਪਨੀ ਜਾਤ ਮੌਦੂਦ ਕਰਨਾ ਚਾਹਤੇ ਹੋਣੇ ਤੋ ਆਜਿਝੀ ਅਪਨਾ ਲੀਕਿਯੇ ਕੁਝੂਂਕਿ ਆਜਿਝੀ ਹੀ ਵੀਛ ਸਿਫ਼ਤ ਹੈ ਜੋ ਫੂਸਰੇ ਦੇ ਇਨਿਤਕਾਮ ਕੇ ਜੁੜ੍ਹੇ ਕੋ ਖਤਮ ਕਰ ਦੇਣੀ।

(4) સબુ મેં મુસાબકત કા એણન બના લીજિયે

બે સભી કી સબ સે બડી વજહ “તબીઅત મેં જલ્દબાજી” હૈ, યેહ જલ્દબાજી હી ઈન્સાન કો અમલી મૈદાન મેં નાકામો નામુરાદ કરવા દેતી હૈ બલિક બા'જ ઔકાત તો ઈસ જલ્દબાજી કી બદૌલત જાન સે ભી હાથ ધોના પડતા હૈ ઈસ કી આમ મિસાલ રોડ પર હોને વાલે હાદિસે હૈનું, લિહાજા અગર આપ હુન્યા વ આખિરત મેં કામયાબી કે ખ્વાહિશ મન્દ હૈનું તો જલ્દબાજી કી આદત ખત્મ કર દીજિયે ઔર સભ મેં એક દૂસરે પર સખ્કત લે જાને કી આદત અપના લીજિયે ઈસ કી બરકતે આપ ખુદ મહસૂસ કરેંગે.

(5) ઇન્નિકામી કારવાઈ કી આદત તર્ક કીજિયે

સભ મેં એક બડી રૂકાવટ કિસી ભી બાત પર આગ બગૂલા હો કર ઇન્નિકામી કારવાઈ કરના ભી હૈ. ઈસ કા આગાજ બુગ્ગો કીના સે હોતા હૈ ઔર અન્જામ બા'જ ઔકાત કલ્યો ગારત પર હોતા હૈ. ઇન્નિકામ કી આગ કો બુગાને કે લિયે અફ્વો દર ગુજર કે ઠને પાની કા છિડકાવ જિતના જિયાદા હોગા સભ કરના ઉતના હી આસાન હો જાએગા લિહાજા અગર સભ કી આદત અપનાના ચાહતે હૈનું તો અપને અન્દર ઇન્નિકામી જગ્ઘબાત કો બેદાર કરને કી બજાએ દર ગુજર સે કામ લીજિયે.

(6) અલ્લાહ કી ને'મતો કો ચાદ કીજિયે

આજમાઈશ છોટી હો યા બડી ઈસ પર વાવેલા કરતે હુવે હમ યેહ ભૂલ જાતે હૈનું કિ **અલ્લાહ ને** હમેં બહુત સી ને'મતો સે

નવાજા હૈ, અગર હમારી તવજજોહ ઐન ઈસ મુસીબત ઔર પરેશાની કે વકત અલ્લાહ ગુરૂજી કી ઈન ને'મતોં કી જાનિબ હો જાએ તો કભી ભી સબ્ર કા દામન હાથ સે ન છૂટે, લિહાજા કિસી ભી આજમાઈશ યા પરેશાની મેં અલ્લાહ ગુરૂજી ને'મતોં હમેશા અપને પેશે નજર રખિયે.

صَلُّوٰ عَلَى الْحَبِيبِ ! صَلُّوٰ عَلَى مُحَمَّدٍ

શબો રોજ કે મા' મૂલાત

આપ રહેલાને શબો રોજ અલ્લાહ કી યાદ મેં ગુજરતે, લોગોં કી સોહબત સે કિનારા કશ રહતે, આપ રહેલાને અકસર ખામોશ રહા કરતે, આપ રહેલાને કી ખામોશી મેં ભી એક કશિશ થી ઔર જબ કભી આપ રહેલાને કુદુરુદુરશાદ ફરમાતે તો ફક્ત એક જુલ્દે મેં કઈ સુવાલોં કે જવાબાત અતા ફરમા દેતે. આપ રહેલાને અપની કરામતોં કો ધૃપાતે, અગર કોઈ ઉસ કા જિક ભી કરતા તો ઉસે નિહાયત ખૂબ સૂરતી સે ટાલ દેતે, આપ રહેલાને તારિકુદુન્યા બુગુર્ગ થે લેકિન દુન્યા કી ઈસ્લાહ કો અપના ફર્જ સમજ કર અદા ફરમાતે, ઈન કીમતી ઔસાફ કી બિના પર આપ રહેલાને દુન્યા કી રૈનક થે. (1)

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! અલ્લાહ કે નેક બન્દે અપની હયાત મેં ઔર બા'દે વજાત ઈન્હીં ઔસાફ કી બિના પર દિલોં પર હુકૂમત કરતે હોય, આજ કે ઈસ પુર ફિતન દૌર મેં ભી

①હજરતે મઘૂમ અલાઉદીન અલી અહમદ સાબિર કલયરી, સ. 81 માખૂજન.

આલ્હાન કે નેક બન્દે ઈસ દુન્યા કી રોનક હેં જિન મેં સે એક અમીરે અહલે સુન્નત બાનિયે દા'વતે ઈસ્લામી હજરતે અલ્લામા મૌલાના અબુ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અત્તાર કાદિરી રજવી ભી હેં. આપ **ડામેથ بِرَبِّكَاثُمُ الْعَالِيَّهِ** કે મુખારક મા'મૂલાત ગુફતાર વ કિરદાર, સીરત વ અખલાક કી અગમત કા એ'તિરાફ બેઠે બેઠે ઉલમા વ મશાઈખ કરતે હેં બલિક એક આમ ઈસ્લામી ભાઈ ભી આપ કી મુલાકાત વ જિયારત કી બરકત સે અપને દિલ કી દુન્યા કો તેરો અબર હોતા મહસૂસ કરતા હૈ. અમીરે અહલે સુન્નત **ડામેથ بِرَبِّكَاثُمُ الْعَالِيَّهِ** કી ચન્દ લમ્હોં કી સોહબત સે તૌબા કી તૌરીક મિલતી હૈ ઔર નેકિયોં પર ઈસ્તિકામત કા જેહન બનતા હૈ, મદની મુજાકરોં મેં આપ **ડામેથ بِرَبِّكَاثُمُ الْعَالِيَّهِ** કે મુખનસર, જામેય ઔર ખૂબ સૂરત મહ્દૂજાત સે ઈલ્યી ઉલજને હલ હો જતી હેં મુખનસરન યેહ કિ આપ **ડામેથ بِرَبِّكَاثُمُ الْعَالِيَّهِ** કે મુખારક મા'મૂલાત મેં ઔલિયાએ કિરામ **رَحْمَةُ اللَّهِ السَّلَامُ** કી સીરત કા અકસ દિખાઈ દેતા હૈ.

صَلُوٰ عَلَى الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

બારગાહે સાબિર મેં ભેજ દિયા

રહ્માનુદ્દીન ઔલિયા હજરતે સાધ્યદુના શર્મુદીન તુર્ક રહ્માનુદ્દીન શર્મુદીન તુર્ક તફસીર વ હટીસ, ફિકદ, રિયાજી વ હિન્દસા જૈસે કર્દ ઉલૂમ પર દસ્તરસ રખતે થે, આપ રહ્માનુદ્દીન અપને વતન સે બાબા ફરીદ ગંજે શકર કી બારગાહ મેં હાજિર હુવે ઔર કુછ અર્સા આપ કી સોહબત મેં રહે ઔર બિલાફિત સે નવાજે ગયે. એક રોજ બાબા ફરીદુદીન ગંજે શકર ને આપ રહ્માનુદ્દીન ને પેશકશ : મજલિસે અલ મદીનતુલ ઈલ્મિયા (દા'વતે ઈસ્લામી)

ફરમાયા : “આપ કા હુસ્લૂલે ને’મત વ કમાલ દૂસરે મુર્શિદ પર મૌકુદું હૈ.” યેહ ફરમા કર હજરતે સચ્ચિદુના શમ્સુદીન તુર્ક રહ્મતુલ્લાહ રહ્મતુલ્લાહ એની કો હજરતે સચ્ચિદુના અલાઉદીન અલી અહમદ સાબિર કલયરી રહ્મતુલ્લાહ એની કી બારગાહ મેં ભેજ દિયા. (1)

તિલાવતે કુરાન ને કેસા મર્તબા દિયા !

જબ હજરતે શમ્સુદીન તુર્ક રહ્મતુલ્લાહ એની કુદિતસાબે ફેઝ કે લિયે કલયર હાજિર હુવે તો ઉસ વકત હજરતે સાબિરે પાક રહ્મતુલ્લાહ એની ગૂલર કે દરખ્ત કે નીચે તનઢા ઈબાદતો રિયાજત મેં મશગૂલ થે, લિલાજા આપ રહ્મતુલ્લાહ એની ભી એક દરખ્ત કે નીચે તશરીફ ફરમા હો કર તિલાવતે કુરાન કરને લગે, જબ હજરતે સચ્ચિદુના અલી અહમદ સાબિર કલયરી રહ્મતુલ્લાહ એની કે કાનોં મેં કલામે ઈલાહી કી મિઠાસ રસ ઘોલને લગી તો આપ રહ્મતુલ્લાહ ઉસ જાનિબ મુતવજ્જેછ હુવે ઔર જિસ સમાન સે આવાજ આ રહી થી ઉસી જાનિબ ચલ પડે, બિલ આભિર એક દરખ્ત કે નીચે હજરતે સચ્ચિદુના શમ્સુદીન તુર્ક રહ્મતુલ્લાહ એની કો બૈઠા પાયા. આપ ભી થોડે ફાસિલે પર તશરીફ ફરમા હો ગયે. જબ હજરતે સચ્ચિદુના શમ્સુદીન રહ્મતુલ્લાહ ને તિલાવત ખત્મ કર કે સર ઉઠાયા તો આપ રહ્મતુલ્લાહ એની કો વહાં મૌજૂદ પા કર ઘબરા ગયે. લેકિન આપ ને નિહાયત નર્માસે ફરમાયા : “શામ્સ ! ઘબરાતે કયું હો ? હમ તુમ સે બહુત ખુશ હોં.” ફિર આપ રહ્મતુલ્લાહ એની બૈઅત સે મુશર્રેફ ફરમાયા ઔર અપને મુખારક હાથોં

①તાજકિરએ ઔલિયાએ પાકો હિન્દ, સ. 76 મુલખ્યસન

સે દસ્તાર બન્ધી ફરમાઈ. આપ રહ્મતુલ્લહી તૃપ્તિ એક તવીલ અર્સે તક મુર્શિદ કી બિદમત મેં રહે, વુગ્ર ભી આપ કરાતે ઔર ખાને કા ઈન્તિજામ ભી ફરમાતે યું આપ રહ્મતુલ્લહી મુર્શિદ કે બિદમત ગુજરાર બન ગયે. ⁽¹⁾

અમીર ખુસરુની મેહમાન નવાજી

બીસ બરસ સે યેહ મા'મૂલ રહા કિ આપ રહ્મતુલ્લહી તૃપ્તિ કે ખલીફા હજરત ખવાજા શમ્સુદીન તુર્ક જંગલ સે ગૂલર તોડ કર લાતે ઔર ઉન્હેં ઉબાલ કર આપ રહ્મતુલ્લહી કી બારગાહ મેં પેશ કર દેતે. એક દફાઓ હજરતે સચિદુના અમીર ખુસરુની રહ્મતુલ્લહી દેહલી સે આપ રહ્મતુલ્લહી કી બારગાહ મેં હાજિર હુવે તો આપ રહ્મતુલ્લહી ને હજરતે સચિદુના અમીર ખુસરુની ખયાલ ફરમાતે હુવે હરશાદ ફરમાયા : “શમ્સુદીન ! ખુસરુની આએ હેં, ઈન કી મેહમાન નવાજી કરની ચાહિયે તાકિ દેહલી જા કર ખવાજા નિગામુદીન ઔલિયા સે યેહ ન કહેં કિ કલયર મેં ખાતિર તવાજોએ ન હુઈ આજ ગૂલર મેં થોડા નમક ભી ડાલ દેના.” હજરતે સચિદુના અમીર ખુસરુની રહ્મતુલ્લહી દેહલી વાપસ જાતે હુવે તબર્કન ગૂલર ભી અપને સાથ લે ગયે ઔર ઉસે સુલાનુલ મશાઈખ હજરતે સચિદુનિગામુદીન ઔલિયા રહ્મતુલ્લહી કી બિદમત મેં પેશ કિયા જિસે આપ રહ્મતુલ્લહી ને આંખોં સે લગાયા ઔર ખૂબ જોક શૌક સે તનાવુલ ફરમાયા. ⁽²⁾

①તજકિરએ ઔલિયાએ પાકો હિન્દ, સ. 76 માખૂજન

②મહફિલે ઔલિયા, સ. 385 મુલખસન

હિન્દુત્વ મહિલાએ ઓર હિન્દુત્વ સાબિરે પાક

હિન્દુત્વ મહિલાએ ઈલાહી હિન્દુત્વ સાથી સાબિર મુહમ્મદ નિઝામુદ્ડીન
ઓલિયા રહ્મતુલ્લહ તૃપુતી હિન્દુત્વ સાબિરે પાક બેહદ
એહતિરામ ફરમાતે થે. આપ રહ્મતુલ્લહ તૃપુતી કુંપાસ સે જબ કોઈ શખ્સ
હિન્દુત્વ સાબિરે પાક રહ્મતુલ્લહ તૃપુતી કુંપાસ મેં હાજિર હોના ચાહતા
તો ઉસે હદ દરજા એહતિરામ કી તાકીદ ફરમાતે નીજ ઈરશાદ
ફરમાતે : કોઈ બાત બિલાકે મિજાજ ન હો. યેહ દોનોં બુઝુર્ગ એક
દૂસરે સે બેહદ મહિલાએ ફરમાતે થે. (1)

શમ્સુદીન મેરા દોસ્ત હૈ

હિન્દુત્વ સાથી હિન્દુના અલાઉદીન અલી અહમદ સાબિર કલયરી
કુંપાસ કી જબાન સે નિકલને વાલે કલિમાત બારગાહે ઈલાહી
મેં બહુત જલ્દ મહિલાએ જાયા કરતે ઈસી લિયે આપ રહ્મતુલ્લહ તૃપુતી
કા લકબ સૈફ લિસાન ભી હૈ. એક ભરતબા આપ રહ્મતુલ્લહ તૃપુતી
હિન્દુત્વ સાથી શમ્સુદીન તુર્ક રહ્મતુલ્લહ તૃપુતી કો પાની લાને કે લિયે
ભેજા જિસ મેં આપ રહ્મતુલ્લહ તૃપુતી સે કુછ તાખીર હો ગઈ, જબ આપ
વાપસ આએ તો હિન્દુત્વ સાથી હિન્દુના અલી અહમદ સાબિર
કલયરી કુંપાસ મુખારક સે યેહ જુમ્લે અદા હો ગએ :
એક પિયાલા પાની લાને મેં ઈતની તાખીર ? શમ્સુદીન ! કયા દિખાઈ

①સિયરુલ અકતાબ મુતર્જમ, સ. 200

નહીં દેતા ? અન્ધે હો ગએ હો, પાની નજર નહીં આયા થા ક્યા ?” જુદ્ધી આપ રહ્મતીલી પાની કા પિયાલા લે કર નોશ ફરમાને કે લિયે તશરીફ ફરમા હુવે તો હજરતે સચ્ચિદુના શમ્સુદીન તુર્ક રહ્મતીલી કે મુંહ સે દર્દભરી આહ નિકલી ફિર ફૈરન આપ રહ્મતીલી કી બારગાહ મેં અર્જ કી : “હુઝૂર ! મૈં તો અન્ધા હો ગયા.” યેહ દેખ કર હજરતે સચ્ચિદુના સાબિર કલયરી સજદા રેઝ હો ગએ ઔર અલ્લાહ રૂજૂજ કી બારગાહ મેં અર્જ ગુજાર હુવે : “યા અલ્લાહ ! રૂજૂજ ! શમ્સ તો તેરે ઈસ ગુનહગાર બન્દ કા દોસ્ત ઔર વાહિદ સાથી હૈ તૂ ઈસ કે હાલ પર રહ્મ ફરમા.” જૈસે હી દુઆ ખત્મ હુર્દ હજરતે સચ્ચિદુના શમ્સુદીન તુર્ક રહ્મતીલી કી બીનાઈ વાપસ આ ગઈ.

નજરે સાબિર કા ઇન્નિખાં

આપ રહ્મતીલી હજરતે સચ્ચિદુના શમ્સુદીન સે બેહદ મહિષ્યત ફરમાતે, એક મરતબા આપ રહ્મતીલી કો મુખાતબ કર કે ફરમાયા : “એ શમ્સ ! તૂ મેરા ફરજન્દ હૈ, મૈં ને ખુદા સે ચાહા કિ મેરા સિલસિલા તુરું સે જરી હો ઔર કિયામત તક રહે.”⁽¹⁾ આખિરી ઉભ્ર મેં આપ રહ્મતીલી ને અપના બિક્રે ખિલાફત હજરતે શૈખ શમ્સુદીન તુર્ક કો અતા ફરમા કર પાનીપત કા સાહિબે વિલાયત મુકર્રર ફરમાયા. આપ રહ્મતીલી ને અપને હાથ સે ખિલાફત નામા લિખ કર ઈન કે હવાલે કિયા ઔર ઈસે આ’જમ જો મરાઈખ સે સીના બ સીના ચલા આ રહા થા ઉસ

¹તાકિરએ ઓલિયાએ પાકો હિન્દ, સ. 76

કી તલ્કીન ફરમાઈ ઔર યેહ વસિયત ફરમાઈ : “તીન દિન સે જિયાદા યહાં ન રહના, **અલ્હાનું** ને આપ કો પાનીપત કી વિલાયત અતા ફરમાઈ હૈ, વહાં જા કર સુકૂનત ઈજિયાર કરના ઔર ભટકે હુવે લોગોં કી હિદાયત મેં કમરબસ્તા હો જાના, મૈં હર જગત તુમ્હારા મુઆવિન રહ્યંગા.” હજરતે શૈખ શમ્સુદીન **રહ્મતેલીધીન** ને બારગાહે મુર્શિદ મેં અર્જ કી : હુજૂર ! આપ કી વિલાયત બાકી ઔર પાઈન્દા હૈ ઈસ બન્દ કા ઈરાદા યેહ થા કિ બાકી ઉમ્ર આસ્તાનએ આલિયા કી જારુબકશી કરતા. અથ આપ કા હુકમ હૈ કિ પાનીપત જાઓ. લેકિન વહાં શૈખ શરહુદીન બૂ અલી કલન્દર પાનીપતી **મૌજૂદ**⁽¹⁾ હૈ મા'લૂમ નહીં કિ વોહ મુજ સે કિસ તરફ પેશ આતે હૈને ? આપ ને **રહ્મતેલીધીન** ને ફરમાયા : ફિક મત કરો તુમ્હારે વહાં પહુંચતે હી વોહ વહાં સે ચલે જાયાંગે.⁽²⁾

મેરા શાસ્ત્ર હી કાફી હૈ !

એક મરતબા શૈખુલ મશાઈખ ખવાજા નિઝામુદીન ઔલિયા કા એક મુરીદ હજરતે સાચ્છદુના અલાઉદીન સાબિર કલયરી કી ખિદમત મેં હાજિર હુવા ઔર અર્જ કી : આપ ને **રહ્મતેલીધીન** ને હજરતે શૈખ શમ્સુદીન તુર્ક કે ઈલાવા કિસી કો મુરીદ ઔર ખલીફા નહીં બનાયા ઔર મેરે મુર્શિદ હજરતે શૈખ નિઝામુદીન ઔલિયા ને આસમાન પર સિતારોં કી તા'દાદ સે ભી

① આપ **રહ્મતેલીધીન** ઈમામે આ'જમ કી ઔલાદ સે હૈને. હદ્દીકતુલ ઔલિયા, સ. 81

② ઈક્તિબાસુલ અન્વાર, સ. 512 મુલાખ્સન, તજકિરાએ ઔલિયાએ પાકો હિન્દ, સ. 76 મુલાખ્સન

ટિયાદા મુરીદ બનાએ હોયાં. આપણાને રહ્મતોની જવાબ દિયા :

“મેરા શમ્સ કાફી હૈ જો અલ્લાહ કે ફઝુલ સે તમામ સિતારોં પર ગાલિબ હૈ.” દેહલી આ કર ઉસ ને સારા વાકિઓ શૈખુલ મશાઈખ ઘ્વાજ નિઝામુદ્દીન ઔલિયા રહ્મતોની સે બયાન કિયા તો આપણાને ફરમાયા : તુમ ને હજરત કો કયું રન્જદા કિયા દૂસરી મરતબા ઐસી હરકત નહીં હોની ચાહિયે બેશક ઉનહોંને જો કુછ ફરમાયા સહીહ ફરમાયા વોહ મુકર્બે બારગાહે રખ્યાની હોયાં. (1)

એક મૌકા પર હજરતે અલાઉદીન અલી અહેમદ સાબિર કલયરી ને હજરતે સાધ્યદુના શમ્સુદ્ડીન તુર્ક રહ્મતોની કે બારે મેં ફરમાયા : હમારા શમ્સ ઔલિયા મેં સૂરજ કી તરહ હૈ. (2)

વિસાલે મુખારક

આપણાને એક દિન શમ્સુદ્ડીન તુર્ક રહ્મતોની સે ફરમાયા : જબ આપ સે કોઈ કરામત જાહિર હો તો સમજ લીજિયેગા કિ મેરા ઈન્નિકાલ હો ગયા હૈ. (3) જિસ દિન હજરતે સાધ્યદુના શમ્સુદ્ડીન તુર્ક રહ્મતોની સે કરામત જાહિર હુદ્દ ફૌરન કલયર શરીર હાજિર હુંબે ઔર આપ રહ્મતોની કી તજહીજો તકફીન, તદ્દીન ખુદ ફરમાઈ. આપણાને કા વિસાલ 13 રબીઉલ અવ્વલ

①સિયલુલ અકતાબ મુતર્જમ, સ. 201 મુલખસન

②તાજકિરથે ઔલિયાએ પાકો હિન્દ, સ. 78

③મહફિલે ઔલિયા, સ. 386 મુલખસન

સિને 690 હિજરી મુતાબિક 15 માર્ચ સિને 1291 ઈસવી હૈ. (1) આપ રહ્માનું કા મજારે પુર અન્વાર કલયર શરીફ જિલ્બ સહારનપુર (યુપી) હિન્દ મેં નહરે ગંગ કે કનારે મર્જુલ ખલાઈક હૈ.

મજાર કી બે હુર્મતી કી હાથો હાથ સગા

એક કાફિર આપ રહ્માનું કે મજાર કે પાસ સે ગુજર રહા થા, ઉસ ને જબ યેહ દેખા કી આપ રહ્માનું કે મજારે પુર અન્વાર પર કોઈ નહીં તો ઉસ કી નિયત ખરાબ હુઈ ઔર ઉસે આપ કા મજારે મુખારક શહીદ કર કે અપની ઈબાદતગાહ તા'મીર કરને કી સૂજી લિધાજા ઉસ ને અપને ઈસ નાપાક ઈરાદે કો અમલી જામા પહ્નાને કે લિયે એક તીશા (એક ઔઝાર) લિયા ઔર અપને નાપાક અજ્રમ કો પૂરા કરને મેં જુત ગયા, જબ ઉસ કી તવજજોહ મજાર કે રોશનદાન કી તરફ ગઈ તો તજસ્સુસ સે ઉસ ને રોશનદાન સે ઝાંક કર અન્દર કા મન્જુર દેખના ચાહા મગર ઉસ કા સર ફંસ ગયા ઔર દમ ઘુટને કી વજહ સે વોહ તડપ તડપ કર ભર ગયા. રાત કો મજાર કે બિદમત ગારોં કે ખ્વાબ મેં હજરતે સચ્ચિદુના અલી અહમદ સાબિર રહ્માનું તશરીફ લાએ ઔર ઈરશાદ ફરમાયા : “એક શખ્સ ગુસ્તાખી કે ઈરાદે સે હમારે મજાર પર આયા થા ઉસે સગા તો મિલ ગઈ હૈ અબ વોહ મજાર કે રોશનદાન સે લટકા હુવા હૈ ઉસે આ કર નિકાલ દિયા જાએ.” દૂસરી સુખ વોહ બિદમત ગાર અપને સાથ્યોં કે સાથ મજાર પર હાજિર હુવે, ઉસ કાફિર કો ખીંચ કર બાહર નિકાલા ઔર ઉસ કી લાશ જંગલ મેં ફેંક દી. (2)

①.....ખજીનતુલ અસ્ક્રિયા 2 / 159, મહિનુલે ઔલિયા, સ. 386 મુલખ્યસન

②.....ખજીનતુલ અસ્ક્રિયા 2 / 158, મુલખ્યસન, ઈક્તિબાસુલ અન્વાર, સ. 505

મુલખ્યસન, તજકિરાએ ઔલિયાએ બરેં સગીર, 2 / 5 મુલખ્યસન

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! વલિયે કામિલ કે મજાર કી બે હુર્મતી કરને વાલે કા ઈથ્રતનાક અન્જામ આપ ને મુલાહજા ફરમાયા, યેહ મદની ફૂલ ખૂબ જેણ નશીન કર લીજિયે કિ “ઔલિયાએ કિરામ رَحْمَةُ اللّٰهِ إِلَيْهِ સે બુગ્ગો અદાવત રખને ઔર ઉન કી ગુસ્તાખી કરને મેં કોઈ ઐર નહીં બલ્કિ દુન્યા વ આખિરત કી બરબાઈ કા ઝરીઆ હૈ.” **અલ્લાહ** عَزُوْجُلٌ કે નેક બન્દોં સે અદાવત કા સબ સે બડા સબબ ગુસ્તાખાને ઔલિયા કી સોહબતે બદ ભી હૈ ઔર ઈસ કી નુહૂસત કી વજહ સે શૈતાન તરણ તરણ કી ગુસ્તાખિયાં કરવાતા હૈ લિહજા ઔલિયાએ કિરામ કી ગુસ્તાખી કરને વાલોં કી સોહબત સે બચને હી મેં આફિયત હૈ. હુબ્બે ઔલિયા બાઈસે ફૌજો ફલાહ (કામયાબી) હૈ ઈસ સિલસિલે મેં અમીરે અહલે સુન્નત બાનિયે દા'વતે ઈસ્લામી હજરતે અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અતાર કાહિરી دَائِمَتْ بِرَبِّكَ اللّٰهُمَّ أَعْلَمُ અપની માયાનાજ તાલીફ ફેઝાને સુન્નત મેં એક હિકાયત નકલ ફરમાતે હૈનું : મક્કાએ મુકર્મા કે એક શાફી મુજાવર કા કહના હૈ, મિસ્ર મેં એક ગરીબ શાખ્સ કે યહાં બચ્યે કી વિલાદત હુઈ ઉસ ને એક સમાજ કારકુન સે રાબિતા કિયા, વોહ નૌમૌલૂદ કે વાલિદ કો લે કર કઈ લોગોં સે મિલા મગર કિસી ને માલી ઈમદાદ ન કી, આખિરે કાર એક મજાર પર હાજિરી હી, ઉસ સમાજ કારકુન ને કુછ ઈસ તરણ ફરિયાદ કી : “યા સચિદી ! **અલ્લાહ** عَزُوْجُلٌ આપ પર રહ્મ ફરમાએ, આપ અપની જાહિરી જિન્દગી મેં બહુત કુછ હિયા કરતે થે, આજ કઈ લોગોં સે નૌમૌલૂદ કે

લિયે માંગા મગર કિસી ને કુછ ન દિયા.” યેહ કહને કે બા’દ ઉસ સમાજ કારકુન ને જાતી તૌર પર આધા દીનાર નૌમૌલૂદ કે વાલિદ કો ઉધાર પેશ કરતે હુવે કહા : “જબ કભી આપ કે પાસ પૈસોં કી તરકીબ બન જાએ મુજે લૌટા દેના.” દોનોં અપને અપને રાસ્તે હો લિયે. સમાજ કારકુન કો રાત ખ્વાબ મેં સાહિબે મજાર કા દીદાર હુવા, ફરમાયા : “આપ ને મુજ સે જો કહા વોહ મૈં ને સુન લિયા થા મગર ઉસ વકત જવાબ દેને કી ઠજાજત ન થી, મેરે ઘરવાલોં સે જા કર કહિયે કિ વોહ અંગીઠી કે નીચે કી જગહ ખોટેં, એક મશકીઝા નિકલેગા ઉસ મેં 500 દીનાર હોંગે વોહ સારી રકમ ઉસ નૌમૌલૂદ કે વાલિદ કો પેશ કર દીજિયે.” ચુનાન્યે, વોહ સાહિબે મજાર કે ઘરવાલોં કે પાસ પહુંચા ઔર સારા માજરા કહ સુનાયા. ઉન લોગોંને નિશાન દેહી કે મુતાબિક જગહ ખોટી ઔર 500 દીનાર નિકાલ કર હાજિર કર દિયે. સમાજ કારકુન ને કહા : યેહ સબ દીનાર આપ હી કે હોંણે, મેરે ખ્વાબ કા ક્યા એ’તિબાર ! વોહ બોલે : જબ હમારે બુજુર્ગ હુન્યા સે પર્દા ફરમાને કે બા’દ ભી સખાવત કરતે હોંણે તો હમ ક્યું પીછે હોટેં ! ચુનાન્યે, ઉન લોગોંને વોહ દીનાર ઉસ સમાજ કારકુન કો દિયે ઔર ઉસ ને જા કર ઉસ નૌમૌલૂદ કે વાલિદ કો પેશ કર દિયે ઔર સારા વાડિયા સુનાયા. ઉસ ગરીબ શાખ્સ ને આધે દીનાર સે કર્જા ઉતારા ઔર આધા દીનાર અપને પાસ રખતે હુવે કહા : “મુજે યેહી કંઈ હૈ.” બાકી સબ ઉસી સમાજ કારકુન કો દેતે હુવે કહા : બંકિયા તમામ દીનાર

ગરીબો નાદાર લોગોં મેં તક્સીમ ફરમા દીજિયે. રાવી કા બયાન હૈ : મુજે સમજ નહીં આતી કી ઈન સબ મેં કોન જિયાદા સખી હૈ ! (1)

અલ્હાનું ગુરૂજાં કી ઉન પર રહમત હો ઔર ઉન કે સદકે હમારી મગફિરત હો.

صَلُّوٰ عَلَى الْحَبِيبِ! صَلُّوٰ عَلَى مُحَمَّدٍ!

ઓલિયા બા'દે વજાત ભી નફા પહુંચાતે હૈ

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! પહલે કે લોગ બુજુગોં કે બારે મેં કિસ કદર અચ્છા અકીદા રખતે થે ઔર બ વક્તે ઝડુરત ઉન સે અપની હાજરેં તલબ કરતે થે. ઉન કા યેહ જેહન બના હુવા હોતા થા કી **અલ્હાનું** વાલે બ અતાએ ઈલાહી ગુરૂજાં મદદ કિયા કરતે હૈનું. બહુર હાલ ઓલિયાઉલ્લાહ અપને રજબે કાએનાત ગુરૂજાં કી ઈનાયાત સે મજારાત મેં હ્યાત હોતે હૈનું, આને જાને વાલોં કી બાત સુનતે હૈનું, હિદાયત વ ઈસ્તિઆનત કરતે હૈનું ઔર અપને ઘરોં કે મુઆમલાત કી ભી ખબર રખતે હૈનું, જભી તો સાહિબે મજાર બુજુગ્યે રહ્મતુલ્લાહ ને ખ્વાબ મેં જા કર ઉસ સમાજ કારકુન કી રહનુમાઈ ફરમાઈ ઔર ઉસ નૌમૌલૂદ કે ગરીબ બાપ કી દસ્તગીરી ઔર માલી ઈમદાદ કી. હજરતે અલ્હામા મૌલાના ઈજને આબિદીન શામી ફરમાતે હૈનું : ઓલિયાઉલ્લાહ રજબે કાએનાત ગુરૂજાં કી બારગાહ મેં મુખ્તાલિફ દરજાત રખતે હૈનું ઔર ઝાઈરીન કો અપને મુઆરિઝો અસરાર કે લિહાજ સે નફા પહુંચાતે હૈનું. (2)

١... لحياء علوم الدين، كتاب ذم البخل وذم حصب المال، حكایات الاستغباء، ٣٠٩/٣

٢... رذائل الحنان، كتاب الصلاة، مطلب في زيارة القبور، ١٧٨/٣، فيضان سنت، أداب طعام، ١/١

મજલિસે મગારાતે ઓલિયા

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! દા'વતે ઈસ્લામી દુન્યા ભરે મેં
નેકી કી દા'વત આમ કરને, સુન્નતોં કી ખુશ્બૂ ફૈલાને, ઈલ્મે દીન કી
શર્માં જલાને ઔર લોગોં કે દિલોં મેં ઔલિયાઉત્લાહ કી મહાય્બત વ
અકીદત બઢાને મેં મસરૂફ હૈ. **الْحَمْدُ لِلّٰهِ عَزَّوَجَلَّ** (તા દમે તહરીર) દુન્યા
કે કમો બેશ 200 મુખાલિક મેં ઈસ કા મદની પૈગામ પહુંચ ચુકા હૈ.
સારી દુન્યા મેં મદની કામ કો મુનજૂઝમ કરને કે લિયે તકરીબન 104
સે જિયાદા મજલિસ કાઈમ હૈનું, ઈન્ધી મેં સે એક “મજલિસે મગારાતે
ઓલિયા” ભી હૈ જો દીગર મદની કામોં કે સાથ સાથ દર્જ જૈલ
ખિદમાત અન્જામ દે રહી હૈ.

1. યેહ મજલિસ ઔલિયાએ કિરામ **رَحْمَةُ اللّٰهِ السَّلَامُ** કે રાસ્તે પર ચલતે
હુવે મગારાતે મુખારકા પર હાજિર હોને વાલે ઈસ્લામી ભાઈયોં મેં
મદની કામોં કી ધૂમેં મચાને કે લિયે કોશાં હૈ.
2. યેહ મજલિસ હતાલ મકદૂર સાહિબે મગાર કે ઉર્સ કે મૌકાએ પર
ઇજતિમાએ જિકો ના'ત કરતી હૈ.
3. મગારાત સે મુલિકા મસાજિદ મેં આશિકાને રસૂલ કે મદની
કાફિલે સફર કરવાતી ઔર બિલ ખુસૂસ ઉર્સ કે દિનોં મેં મગાર શરીફ
કે ઈહાતે મેં સુન્નતોં ભરે મદની હલ્કે લગાતી હૈ જિન મેં વુજુ, ગુરુલ,
તયમુમ, નમાઝ ઔર ઈસાલે સવાબ કા તરીકા, મગારાત પર
હાજિરી કે આદાબ ઔર ઈસ કા દુરુસ્ત તરીકા નીજ સરકારે મદીના
كَلِّ اللّٰهُ تَعَالٰى عَنِيهِ وَاللّٰهُ وَسَلَّمَ કી સુન્નતે સિખાઈ જાતી હૈનું.

4. આશિકાને રસૂલ કો હરબે મૌકાએ અથડી અથડી નિયતોં મસલન બા જમાઅત નમાજ કી અદાએગી, દા'વતે ઈસ્લામી કે હફ્તાવાર સુન્તતોં ભરે ઈજિતમાઆત મેં શિર્કત, દર્સે ફેઝાને સુન્તત દેને યા સુનને, સાહિબે મજાર કે ઈસાલે સવાબ કે લિયે હાથોં હાથ મદની કાફિલોં મેં સફર ઔર ફિકે મદીના કે જરીએ રોજાના મદની ઈન્દ્રામાત કા રિસાલા પુર કર કે હર મદની યા'ની કમરી માણ કી પહ્લી તારીખ કો અપને જિમ્મેદાર કો જમ્મા કરવાતે રહ્ને કી તરફોબ દી જાતી હૈ.

5. “મજલિસે મજારાતે ઔલિયા” અય્યામે ઉર્સ મેં સાહિબે મજાર કી બિદમત મેં ઢેરોં ઢેર ઈસાલે સવાબ કા તોહ્ફા ભી પેશ કરતી હૈ ઔર સાહિબે મજાર બુગ્જુગ્જુ કે સજજાદા નશીન, ખુલફા ઔર મજારાત કે મુતવલ્લી સાહિબાન સે વક્તન ફ વક્તન મુલાકાત કર કે ઉન્હેં દા'વતે ઈસ્લામી કી બિદમત, જામિઆતુલ મદીના વ મદારિસુલ મદીના ઔર બૈરુને મુલ્ક મેં હોને વાલે મદની કામ વગૈરા સે આગાહ રખતી હૈ.

6. મજારાત પર હાજિરી દેને વાલે ઈસ્લામી ભાઈયોં કો શૈખે તરીકત, અમીરે અહલે સુન્તત ડામથ بِرَبِّكُلَّهُمُ الْعَالِيَهُ કી અતાકદ્રા નેકી કી દા'વત ભી પેશ કી જાતી હૈ.

اَللّٰهُمَّ اسْتَغْفِرُكَ لِمَا تَأْتِنِي وَلَا تُؤْخِذْنِي
 કા અદબ કરતે હુવે ઉન કે દર સે ફેઝ પાને કી તૌફીક અતા ફરમાએ
 ઔર ઈન મુખારક હસ્તિયોં કે સદકે દા'વતે ઈસ્લામી કો મજીદ
 તરકિક્યાં અતા ફરમાએ. **اَمِين بِجَاهِ النَّبِيِّ الْاَمِينِ مَوْلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَاللَّهُ وَسَلَّمَ**

صَلُّوْا عَلَى الْحَبِيبِ! صَلُّوا عَلَى مُحَمَّدٍ

પેશકશ : મજલિસે અલ મદીનતુલ ઈલ્મિયા (દા'વતે ઈસ્લામી)

મગારાતે ઔલિયા પર લગાએ જાને વાલે તરબિયતી હલ્કો કે મૌગ્લુઆત

હલ્કા નંબર 1 મજારાતે ઔલિયા પર હાજિરી કા તરીકા

હલ્કા નંબર 2 વુજૂ, ગુસ્લ ઔર તયમુખ કા તરીકા

હલ્કા નંબર 3 નમાજ કા સબક

હલ્કા નંબર 4 નમાજ કા અમલી તરીકા

હલ્કા નંબર 5 રાહે ખુદા મેં સફર કી અહિભિયત (મદની કાફિલોં કી તયારી)

હલ્કા નંબર 6 દુરુસ્ત કુરાને પાક પઢને કા તરીકા

હલ્કા નંબર 7 નેક બનને ઔર બનાને કા તરીકા (મદની ઈન્ચામાત)

હિદાયાત : મદની હલ્કે મજાર કે ઠહાતે કે કરીબ હો જિસ મેં દો ઘેર ખ્વાહ મુકર્રર કિયે જાએં જો દા'વત દે કર જાઈરીન કો હલ્કે મેં શિર્કત કરવાએં. હર હલ્કે કે ઠપ્ણિતામ પર ઈનફિરાદી કોશિશ કી જાએ ઔર અચ્છી અચ્છી નિયતેં કરવાઈ જાએં ઔર નામ વ નંબર્ડ મદની પેડ પર તહરીર કિયે જાએં.

મજારાતે ઔલિયા પર મદની હલ્કો મેં દી જાને વાલી નેકી કી દા'વત

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! આપ કો મજાર શરીફ પર આના મુખારક હો, **اللَّهُمَّ تَبَارَكْتُكَ** તબ્લીગો કુરાનો સુન્તત કી આલમગીર ગૈર સિયાસી તહરીક દા'વતે ઈસ્લામી કી તરફ સે સુન્તતોં ભરે મદની હલ્કોં કા સિલસિલા જારી હૈ, યકીનન જિન્દગી બેહદ મુખ્તસર હૈ, હમ લમ્છા બ લમ્છા મૌત કી તરફ બઢતે ચલે જા રહે હોએ,

પેશકશ : મજાલિસે અલ મદીનતુલ ઈલ્મિયા (દા'વતે ઈસ્લામી)

અન કરીબ હમેં અંધેરી કબ્ર મેં ઉત્તરના ઔર અપની કરની કા ફલ ભુગતના પડેગા, ઈન અનમોલ લમ્ફાત કો ગનીમત જાનિયે ઔર આઈયે ! અહૃકામે ઈલાહી પર અમલ કા જગ્ઞબા પાને, મુસ્તિશ જાને રહેમત કી સુન્નતેં ઔર **અહ્�લાન** **عَزَّوَجَلٌ** કે નેક બન્દોં કે મજારાત પર હાજિરી કે આદાબ સીખને સિખાને કે લિયે મદની હલ્કોં મેં શામિલ હો જાઈયે. **અહ્�લાન** તથાલા હમ સબ કો દોનોં જહાં કી ભલાઈયોં સે માલા માલ ફરમાએ. (1)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلُّوا عَلَى مُحَمَّدٍ!

મનકબત દર હુગ્રે પુરનૂર સાચિયદુના અલાઉલ મિલ્લતે વદીન અલી અહ્મદ સાબિર

કેસે કાઢું રતિયાં સાબિર
મોરે કરજવા છૂક ઉઠત હૈ
તોરી સૂરતિયા ઘારી ઘારી
ચેરી કો અપને ચરનોં લગા લે
ડોલે નથ્યા મોરી ભંવર મેં
ઇતિયાં લાગિન કેસે કહું મૈં
તોરે દ્વારે સીસ નવાજી
સપને હી મેં દર્શન દિખલા દો
તન મન ધન સબ તો પે વારે

તારે ગિનત છું સથ્યાં સાબિર
મો કો લગા લે ઇતિયાં સાબિર
અચ્છી અચ્છી બતિયાં સાબિર
મેં પહું તોરે પથ્યાં સાબિર
બલમા પકડે બથ્યાં સાબિર
તુમ હો ઊંચે અટરિયાં સાબિર
તેરી લે લું બલથ્યાં સાબિર
મો કો મોરે ગસથ્યાં સાબિર
નૂરી મોરે સથ્યાં સાબિર

(સામાને બણિશાશ, સ. 77)

①મજારાતે ઔદિયા કી હિકાયાત, સ. 32

માહ્દ ઓમરાજુ

ક્રમાંક	ત્રણાન પાક	કાલી
નંબર શાહ	કાનુંબ	કાનુંબ
1	قرآن كنز الایمان	مطبوعہ مکتبہ المدینہ، باب المدینہ کراچی دارالفکر بیروت، ۱۴۲۳ھ
2	سنن الترمذی	دارالفکر بیروت، ۱۴۲۰ھ
3	معجم الزوائد	دارالكتاب العلمیہ بیروت، ۱۴۲۱ھ
4	شعب الایمان	دارالكتاب العلمیہ بیروت، ۱۴۲۱ھ
5	كتو العمال	دارالكتاب العلمیہ بیروت، ۱۴۲۱ھ
6	المعجم الكبير	دارالكتاب العلمیہ بیروت، ۱۴۲۲ھ
7	العاجم الصغير	دارالكتاب العلمیہ بیروت، ۱۴۲۵ھ
8	فيض التدبر	دارالكتاب العلمیہ بیروت، ۱۴۲۲ھ
9	مرقة السفاتيحة	دارالفکر بیروت، ۱۴۲۱ھ
10	ردد المحثار	دارالسُّعْرَة بیروت، ۱۴۲۰ھ
11	اخبار الاخبار	قاروں اکیڈمی، خیبر پور پاکستان
12	احیاء علوم الدین	دارصادن بیروت، ۲۰۰۰ء
13	تلپیس ابليس	دارالكتاب العربي، ۱۴۱۳ھ
14	كتاب المفردات	شیخ غلام علی ایڈن سزمنر کرزاولیاء لاہور
15	حدیقتہ الاولیاء	قصوف فاؤنڈیشن، مرکز الاولیاء لاہور 2000ء
16	صفات الکاملین	الجمال جھنگ بازار قیصل آباد
17	تذکرہ الاولیاء بر صفحہ	ملک ایڈن سعید رحمن بارکیٹ مرکز الاولیاء
18	تذکرہ حضرت بهاء الدین زکریا ملتانی	محلمہ او تاق پنجاب، مرکز الاولیاء لاہور 1980ء
19	نفائت الانس مترجم	شیخ برادر ز، مرکز الاولیاء لاہور 2002ء
20	حضرت مخدوم علاؤ الدین علی احمد صابر کلیری	رضائیلی کششمر کرزاولیاء لاہور ۱۴۲۲ھ
21	خزینۃ الاصفیاء مترجم	مکتبۃ نوبیہ، مرکز الاولیاء لاہور 2010ء
22	مراۃ الاسراء مترجم	اشیعیل، مرکز الاولیاء لاہور، 2006ء
23	تاریخ شاہزاد قدریہ	بزم قاسمی برکاتی بدایوں شریف 2001ء
24	تذکرہ حضرت صابر کلیری	تذکرہ سزیر پبلشرز مرکز الاولیاء لاہور

شیبیر ادرز، مرکز الائولیاء لاہور 2000ء	تذكرة الائولیاء یاک و ہند	25
علم دین پیشرز، مرکز الائولیاء لاہور	الله کے خاص بندے	26
نقیس اکیڈمی، طباعت دوم، 1987ء	سیر الاقطب مترجم	27
القیصل، مرکز الائولیاء لاہور	اقبال الانوار	28
محظوظ	فخر التواریخ	29
مکتبۃ المدینہ، باب المدینہ کراچی	ترمیت اولاد	30
زادیہ پیشرز، مرکز الائولیاء لاہور 2011ء	محفل اولیاء	31
مکتبۃ المدینہ، باب المدینہ کراچی	هزاریت اولیاء کی حکایات	32
مکتبۃ المدینہ، باب المدینہ کراچی	فیضان سنت	33
رضوی کتاب گردھی نمبر ۵۰۱۲، ۲۰۰۵ء	سامانی بخشش	34

નેક બન્દે કી પહ્યાન કચા હૈ ?

સરકારે નામદાર, દો આલમ કે માલિકો
મુખ્તાર, શહનશાહે અભરાર કા ઈરશાદ
હીકૃત બુન્ધાદ હૈ : બેશક લોગોં મેં સે વોહ લોગ બુરે હૈન
જિન સે લોગ મહંગ ઉન કે શર કી વજહ સે બચતે હો.

(મુત્તુ માલિક, ج ۲، ص ۳۰۳، حદિથ ۱۷۱۹)

મનીદ સુલ્તાને દો જહાન, શહનશાહે કૌનો
મકાન, રહમતે આલમિયાન કા ફરમાને
આલીશાન હૈ, **અલ્હાઠ** તથાલા કે નેક બન્દે વોહ હૈન
જિન્હેં ટેખેં તો **અલ્હાઠ** ગ્રાહ આ જાણે ઔર **અલ્હાઠ**
તથાલા કે બુરે બન્દે વોહ હૈન જો ચુગલ ખોરી કરતે, દોસ્તોં
મેં જુદાઈ ડાલતે ઔર નેક લોગોં કે એબ તલા� કરતે હૈન.

(مسند امام احمد, ج ۲، ص ۲۹۱، حદિથ ۱۸۰۲۰)

ફેલસિસ્ટ

ઉનવાન	સફળા	ઉનવાન	સફળા
હુરદ શરીર કી ફીજીલત	1	મેરે હિલ કા ઈલ્મ અલાઉંડીન કે પાસ હૈ	17
કમાલે સથ્ર ને સાબિર બના હિયા	1	ભિલાઝિત કી અજીમુશાન મહફિલ	18
વિલાદતે બા સાચાદત	3	કલયર કી ભિલાઝિત	19
શરૂરાએ નસબ	3	કલયર આમદ	20
કાન મેં અજાન	4	આજ યેહ સુન્નત ભી અદા હો ગઈ !	21
નામ વ લક્ષ્મિ મેં ભી ઈન્નિયાજી શાન	5	અહ્લાન્ હિલ કે વલી કી હિલ	
વાલિફેન	6	આજારી કા અન્જામ	23
જાબાન સે અદા હોને વાલા પહેલા જુલ્દા	6	અણ વ મા'ખૂદ કે માબૈન ફર્જ	25
જાબાન ખુલને કે બા'દ અહ્લાન્ હિલ		નયાજ સે મહિષ્યત	25
કા નામ સિખાઈયે	7	લિબાસ	26
બચ્ચે કો જિન્હુલ્લાહ ઐસે સિખાઈયે	7	બા ઈમામા રહના અકલમન્દી કી અલામત હૈ	26
તહજીજુદ કી પાબન્દી ફરમાતે	8	બુર્દાર બનને કા આસાન અમલ	27
બચપન કી એક ઘ્યારી આદત	8	આપ કી ગિયા	27
છોટી સી ઊમેં હી રોગ રખને કા મા'મૂલ	9	એક ગેર મુસ્લિમ કા કબૂલે ઈસ્લામ	29
રોજે સે સિહ્ધહંહ મિલતી હૈ	9	મેહમાનોં કી પેર જ્વાહી ફરમાતે	30
બચપન હી મેં સજદોં સે મહિષ્યત	10	જિન્હાં કે હર પહૂલું સે સથ્ર જલકતા	31
સાંપ કે ગરર સે નજીત કી ખુશ ખખરી	11	સથ્ર કે ફગાઈલ પેશે નજર રખિયે	31
તીન સાલ મેં ઉલૂમે જાહિરી કી તકમીલ	12	બારગાહે ઈલાહી મેં દુઓ કીજિયે	32
દાદા કી વજાત કી પેશગી ખખર દે દી	15	આજિઝી અપના લીજિયે	32
ઔલિયા ભી ગૈબ જાનતે હૈં	15	સથ્ર મેં મુસાબકત કા જેઝન બના લીજિયે	33

પેશકશ : મજલિસે અલ મદીનતુલ ઈલ્મિયા (દા'વતે ઈસ્લામી)

ઈન્દ્રિયામાં કારવાઈ કી આદત તર્ક કીજિયે	33	નજરે સાબિર કા ઈન્દ્રિયાબ	39
અલ્હાહ <small>عَزَّوَجَلَّ</small> કી ને'મતોં કો યાદ કીજિયે	33	મેરા શાખા હી કાફી હૈ !	40
શખો રોજ કે મા'મૂલાત	34	વિસાલે મુખારક	41
બારગાહે સાબિર મેં ભેજ દિયા	35	મજાર કી બે હુર્મતી કી હાથોં હાથ સર્જા	42
તિલાવતે કુરાનને કેસા મર્તલા દિયા !	36	ઔલિયા બાઢે વફાત ભી નફાન પહુંચાતે હૈન	45
અમીર ખુસરુ કી મેહમાન નવાજી	37	મજલિસે મજારાતે ઔલિયા	46
હજરતે મહિબૂબે ઈલાહી ઓર હજરતે સાબિરે પાક	38	મનકબત	49
શમ્ખુદીન મેરા દોસ્ત હૈ !	38	માખજો મરાજેઅ	50

સબ કબ્ર વાલોં કો સિફારિશી બનાને વાલા અમલ

સુલ્તાને દો જહાન صَلَّى اللّٰهُ تَعَالٰى عَلٰى عَبْدِهِ وَسَلَّمَ કા ફરમાને શર્ફાયત નિશાન હૈ : જો શાખસ કબ્રિસ્તાન મેં દાખિલ હુવા કિર ઉસ ને સૂરતુલ ફાતિહા, સૂરતુલ ઈખલાસ ઓર સૂરતુલાસુર પદી કિર યેહ દુઆ માંગી : “યા **અલ્હાહ** عَزَّوَجَلَّ ! મૈં ને જો કુછ કુરાનની પઢા ઈસ કા સવાબ ઈસ કબ્રિસ્તાન કે મોમિન મર્દીઓ ઓર મોમિન ઓરતોં કો પહુંચા તો વોહ સબ કે સબ ડિયામત કે રોજ ઈસ (યા'ની ઈસાલે સવાબ કરને વાલે) કે સિફારિશી હોંગે. (૩૧) شَرْحُ الصُّدُورِ، ص ٣١

હર ભલે કી ભલાઈ કા સદકા ઈસ ખુરે કો ભી કર ભલા યા રબ !



QUITBE AALAM KI AJEEB KARAMAT (GUJARATI)

ફેઝાને મદની મુઝાકરા (કિંશા : 20)

કૃતલે આલમ કી અજુલ કરામત

(મખ દીગર દિલચસ્પ સુવાલ જવાબ)



પેશકરણ : -

મજલિસે આલ મદીનતુલ ઈલ્મિયા
(દા'વતે ઈસ્લામી)




યેહ રિસાલા શૈખ
તરીકત, અમીરે આહેદે
સુન્ત, બાનિયે દા'વતે
ઈસ્લામી હજરતે
અલ્લામા મૌલાના અખૂ
બિલાલ મુહમ્મદ
ઈલ્યાસ અતાર કાહિરી
રજીવી જિયાઈ
કે મદની મુઝાકરા
નાભર 9 કે મવાદ
સમેત અલ મદીનતુલ
ઈલ્મિયા કે શો'યે
“ફેઝાને મદની
મુઝાકરા” ને નઈ
તરતીબ ઔર કસીર
નાથે મવાદ કે સાથ
તથાર કિયા છે.

الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْمُرْسَلِينَ أَمَّا بَعْدُ فَاعُوذُ بِاللّٰهِ مِنَ السُّكُونِ الرَّجِيمِ طَبِّسُمُ اللّٰهُ الرَّحْمٰنُ الرَّجِيمُ ط

નેક નમાઝી બનને કે લિયે

હર જુમા' રાત બા'દ નમાજે ઈશા આપ કે યહાં હોને વાલે દા'વતે ઈસ્લામી કે હફ્તાવાર સુન્નતો ભરે ઈજતિમાઅ મેં રિઝાએ ઈલાહી કે લિયે અચ્છી અચ્છી નિય્યતો કે સાથ સારી રાત શિર્કત ફરમાઈયે ઝ સુન્નતો કી તરબિયત કે લિયે મદની કાફિલે મેં આશિકાને રસૂલ કે સાથ હર માહ તીન દિન સફર ઔર ઝ રોજાના “ફિકે મદીના” કે જરીએ મદની ઈન્નામાત કા રિસાલા પુર કર કે હર મદની માહ કી પહોલી તારીખ અપને યહાં કે જિમ્મેદાર કો જમ્મુ કરવાને કા મા'મૂલ બના લીજિયે.

મેરા મદની મકસાદ : “મુજે અપની ઔર સારી હુન્યા કે લોગોં કી ઈસ્લાહ કી કોશિશ કરની હે.”. “ઇન્ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ” અપની ઈસ્લાહ કે લિયે “મદની ઈન્નામાત” પર અમલ ઔર સારી હુન્યા કે લોગોં કી ઈસ્લાહ કી કોશિશ કે લિયે “મદની કાફિલો” મેં સફર કરના હે. “ઇન્ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ”



- : નાશિર :-

મકતબતુલ મદીના, ફાને મદીના, ગ્રીકોનિયા બગીયે કે સામને, મિરાપુર,

અહમદાબાદ-1, ગુજરાત, અલ હિન્દ ફોન : 9327168200

Web : www.dawateislami.net / E-mail : maktabahmedabad@gmail.com